

॥ ષામોડત્થુણાં સમણસ્સ ભગવાનો મહાવીરસ્સ ॥

પૂ.આ. અભયશેખરસ્સુરિ લિખિત પુસ્તક
‘તિથિ અંગે સત્ય અને સમાધાન’
(ભાગ-૨) પુરસ્તકની

એક તટરચ સમીક્ષા

(ભાગ-૨)

: લેખક તથા પ્રકાશક :

કિરણ બી. શાહ

૬/સી-૪, માતૃઆશિષ, ૩૮-નેપિયન્સી રોડ,
મુંબઈ - ૪૦૦ ૦૩૬.

અન્યાયની સામે ન્યાયની લડત રહેવાનીજ છે.

રામચંદ્રજીએ રાવણની સાથે યુદ્ધ કર્યું નથી, કરવું પડ્યું છે. શ્વેતાંબરો દિગંબરો સામે કોઈ ગયા ત્યારે વાત વાતમાં કોઈ કેસ શા માટે કરવા ? તેમ કોઈ કહેતું નથી. ઉપરથી તેના માટે ફંડફાળા થાય છે. બધા જ સમજે છે કે અન્યાય સામે, સિદ્ધાંતરક્ષા સામે, તમામ સમજદારીના પ્રયત્નો કર્યા બાદ જે કોઈ જ ન્યાય ન મળે તો કોઈ જવું જ પડે છે. તેજ રીતે તપાગચ્છના શાસ્ત્ર સિદ્ધાંતોને જ્યારે બહુમતિના જેરે કચડવાના નિભન્કક્ષાના પ્રયત્નો થતા હોય ત્યારે સિદ્ધાંત રક્ષા ખાતર, સમજવવાના તમામ પ્રયત્નો કરવા છતાં જક્કી વલણ અપનાવવામાં આવે ત્યારે જ કોઈમાં ન્યાય માટે ધા નાખવી પડે છે.

જણવા મળ્યા મુજબ માટુંગા કેસમાં બહુમતિના જેરે અને અયોગ્ય માર્ગદર્શન દ્વારા તપાગચ્છના શાસ્ત્ર સિદ્ધાંતોને નુકશાન પહોંચાડવાના નિભન્કક્ષાના પ્રયત્ન કરવામાં આવ્યા ત્યારે સમજવવાના તમામ પ્રયાસો કર્યા છતાં જક્કી વલણ અપનાવવામાં આવ્યું. ન છૂટકે ન્યાયનો માર્ગ લેવો પડ્યો અને તેમાં એક તિથિ પક્ષે આઠ આઠ વાર કોઈમાં હાર ખમવી પડી છે. આમાં જે શ્રમણ ભગવંતોએ અયોગ્ય માર્ગદર્શન આપ્યું તેના કારણે એક તિથિ પક્ષની પ્રતિષ્ઠાને ગંભીર ફટકો પડ્યો છે. પોતાની ગંભીર ભુલોને ઢાંકવા હવે, ‘વારે વારે કોઈ કેસ શા કરવા ?’ ની કાગારોળ મચાવવામાં આવે છે.

॥ ઇમોડતથુણં સમાણસ્સ ભગવાનો મહાવીરસ્સ ॥

પૂ.આ. અભયશેખરસૂરિ લિખિત પુસ્તક
'તીવ્યિ અંગે સત્ય અને સમાધાન'
(ભાગ-૨) પુસ્તકની

એક તટરચ સમીક્ષા

(ભાગ-૨)

: લેખક તથા પ્રકાશક :

કિરણ બી. શાહ

૬/સી-૪, માતૃઆશિષ, ૩૮-નેપિયન્સી રોડ,
મુંબઈ - ૪૦૦ ૦૩૬.

પ્રથમ આવૃત્તિ નકલ ૧૦૦૦

વિ.સं. ૨૦૬૨

: પ્રાપ્તિ સ્થાન :

૧ એ.કે. ડાયમણ્ડસ

૨૧૦૪-ચે, પંચરત્ન,
ઓપરા હાઉસ, મુંબઈ-૪.

૩ શ્રી બિજલભાઈ ગાંધી

૬-પ્રેમલ ફ્લેટ, વિકાશગૃહ રોડ,
પાતડી, અમદાવાદ - ૭.

૨ શ્રી ભરતભાઈ તુ. જ્યેઠી

૨૩-સદાશીવ લેન, વોરા બિલ્ડિંગ,
૪ થેમાળે, ૩મ નં.૫,
મુંબઈ - ૪૦૦ ૦૦૪.

૪ શ્રી બરેબ્રભાઈ મહેતા

૬/૨૨૦૩, નાગરશોરી,
મહિંદ્રામુરા, સુરત.

મૂલ્ય-૨૦૦સત્ત્રવઙ્કાઢારી

: લેખક તથા પ્રકાશક :

કિરણ બી. શાહ

૬/સી-૪, ભાતૃઆશિષ, ૩૮-નેપિયન્સી રોડ,
મુંબઈ - ૪૦૦ ૦૩૬.

પ્રાસ્તવિક

શાસ્ત્ર નિરપેક્ષ એકતાની ઘેલછા અન્યો વિતંડાવાદજ છે.

પ. પૂ. આ. અભયશોભરસૂરિ લિખિત 'તિથિ અંગે સત્ય અને સમાધાન' ભાગ-૨ અંગે સારુંપે કંઈક કહેલું હોય તો એટલું જ કહી રકાય કે તે ભાગ-૨ 'એર ઉપરનો વધાર છે'

શાસ્ત્ર સાપેક્ષ એકતાજ આવકાર્ય છે. શાસ્ત્રનિરપેક્ષ એકતા એ નયો વિતંડાવાદજ છે. આવી શાસ્ત્રનિરપેક્ષ,

જે એકતાની ઘેલછાએ શાસ્ત્ર વચ્ચનોને પુરુષલાત્મક વચ્ચનો કહાં,

જે એકતાની ઘેલછાએ શાસ્ત્રપાઠો ભુલાવ્યા,

જે એકતાની ઘેલછાએ પોતાના ગુરુ-દાદાગુરુ ભગવંતોને નિઝનક્ષાએ મુકી દીધા,

જે એકતાની ઘેલછાએ ગીતાર્થતા ભુલાવી,

જે એકતાની ઘેલછાએ સંસ્કારના નામે કુસંસ્કાર, તર્કના નામે કુતકો વિ. ની લ્હાણી કરી,

જે એકતાની ઘેલછાએ સૂચક દ્રાઘાંતોના નામે અધિત દ્રાઘાંતો આપી મહા અનર્થ વિભો કર્યો,

જે એકતાની ઘેલછાએ દ્રવ્યસત્ય અને ભાવસત્યના મનઘડંત અને કપોળકલિપત અર્થઘટન કર્યા:

આવી સત્યને છેલ દેનારી શાસ્ત્રનિરપેક્ષ એકતાની ઘેલછા નહિ અટકાવવામાં આવે તો તપાગચ્છના શાસ્ત્રસિદ્ધાંતો છિન્નલિન થઈ જશે.

પ્રસ્તુત પુસ્તક ભાગ-૨ માં મારા પુસ્તક (તત્ત્વ સમીક્ષા)ની સામે લેખકશ્રીએ જે ખુલાસાઓ કર્યા છે તે નેતા કોઈપણ તત્ત્વ વ્યક્તિ સમજ રકે છે કે તે માત્ર હવાની વાતો જ છે. કોઈ નક્કર પુરાવા વિના, શાસ્ત્રપાઠો વિના પોતાના જ પૂજયો માટે નિઝનક્ષાની વાતો હવામાં કરવી તે જરાપણ શોભાસ્પદ નથી. તેના અંગે મારે ખુલાસો કરવાનો રહેતો નથી. છતાં લેખકશ્રીની મનોદરા જિજાસુઓ સુધી પહોંચે અને તે મનોદરાનું વાસ્તવિક સ્વરૂપ જિજાસુઓ સમજે અને તેથીજ તેવી મનોદરાનો ત્યાગ કરી રકે અને શાસ્ત્રને સમર્પિત રહે એજ એક શુલ્ભ આશાયથી મેં તત્ત્વ સમીક્ષા ભાગ-૨ બહાર પાડી છે.

અંતે સૌ કોઈના હૈયામાં શાસ્ત્રો એજ આપણું સર્વસ્વ છે તે ધ્વનિત થાય, 'સાધવ: શાસ્ત્ર ચક્ષુષः' પૂ. ઉપા. યશોવિજયણ મહારાજના શબ્દોને આપણો જીવનના અંત સુધી વધાદાર રહીએ અને તે રીતે સૌ કોઈ સ્વપરિની મુક્તિને નણક લાવે તેજ ઓકની એક પરમાત્માને પ્રાર્થના.

જિનાજા વિચ્છદ કંઈપણ લખાયું હોય તો નિવિદે નિવિદે ભિચ્છામિ દુક્કડમ.
લી.

કિરણ બી. શાહ

ગીતાર્થમાટે એટલે શાસ્ત્રમતિ, નહિ કે સ્વમતિ

ગીતાર્થોને થતો બોધ એ શાસ્ત્રમતિ નથી, પણ ગીતાર્થોને શાસ્ત્રાનુસારે થતો બોધ એ શાસ્ત્રમતિ અર્થાત્ ગીતાર્થમતિ છે. અને શાસ્ત્રાનુસારે થતી ગીતાર્થમતિ એજ સૌથી વધારે મહત્વની છે. તે રીતે શાસ્ત્રાનુસારે ગીતાર્થમતિ ન થઈ માટે જ તો, વિ.સં. ૨૦૪૨માં પદ્ધકઉપર સહીઓ કર્યા પછી એકતિથિ પક્ષના કેટલાકે સહીઓ પાછી ખેચી લીધી,

વિ.સં. ૨૦૪૨માં કેટલાક એકતા વાદીઓએ સહી કરવાનો ઠંકાર કરી દીધો.

વિ.સં. ૨૦૪૪માં સંમેલનમાં ગીતાર્થોએ સર્વસંમત શાસ્ત્રીય નિષાયો લીધા છે તેવો વારે વારે એકતાનો કરેલો દાવો પોકળ પુરવાર થયો. સંમેલન ખોખડું પુરવાર થયું.

વિ.સં. ૨૦૪૪ના સંમેલનના અધ્યક્ષને પણ પોતાની સ્પષ્ટ અસંમતિ હોવા છતાં અતિશાય દબાણના કારણે સંમતિ આપવી પડી.

વિ.સં. ૨૦૪૪ના સંમેલનના પ્રવર સમિતિના આચાર્ય નરેન્દ્રસાગરજીને સંમેલનમાંથી છૂટા થવું પડ્યું. તેમના ઉપર પણ અભિયોગ-બિભિન્નિકા આદિ પ્રયોગ કરવામાં આવેલા. અને તે છૂટા થયા એટલે તેમને 'મહેતાળ' તરીકે નિન્નકક્ષાએ મૂકવામાં આવ્યા.

સંમેલનના અધ્યક્ષ પૂ.આ. રામસુરિ ડહેલાવાળાના પત્રમાં સ્પષ્ટ જણાવેલ છે કે, 'પરિસ્થિતિ એટલી બધી વણસી ચૂકી હતી કે - જે તે-તે (માંગણી કરનાર) સમુદ્ધાયને આ સમિતિમાં પ્રવેશ ન મળે તો સંમેલનથી છૂટા થવાની તૈયારી વાળા હતા.'

સંમેલનના અધ્યક્ષ અને પ્રવર સમિતિના આચાર્ય ભગવંતની આવી અવદશા થઈ ! તો બીજાનું તો શું થયું હશે ?

પૂ.આ. નરેન્દ્રસાગરસુરિના શબ્દોમાં, 'શ્રી શ્રમણ સંમેલને આ નિર્ણયો કરવા પાછળ શાસ્ત્રપરંપરાના આધારો કરતાં વર્તમાન દ્રવ્ય-ક્ષેત્ર કાળ-ભાવને વધુ પ્રાધાન્ય આપ્યું છે' ક્યાં રહી શાસ્ત્રમતિ ? ક્યાં રહી ગીતાર્થમતિ ?

માટે જ શાસ્ત્રકારો બહુ જ સ્પષ્ટ શબ્દોમાં કહે છે કે, જૈન શાસનમાં શાસ્ત્રમતિ જ સર્વોપરી છે.

ટૂંકમાં વિ.સં. ૨૦૪૪ના સંમેલનના નિર્ણયો ઉપરોક્ત પરિસ્થિતિ અનુસારે તથા શાસ્ત્રમતિ અનુસાર ન હોવાથી તે વિસર્જિત થયેલા જ છે. હવે તે મૃતકને ખલે લઈને ફરનારા લેખકશ્રી તેને જીવંત કરવાનો વ્યર્થ પ્રયત્ન કરે છે.

વિષયાનુક્રમ

ક્રમ	વિષય	પૃષ્ઠ
૧	આ સર્વજાનું બંધારણ છે-ચણોડીની સરખામણી સોના સાથે ન થાય	૧
૨	આ રહી શાસ્ત્રોની સાચી તારવણી	૩
૩	પૂ.આ.શ્રી દાન સુ.મ.નો પ્રાણશબ્દ 'સ્વમતિ'લેખકશ્રી ઈરાદા પૂર્વક ઉડાવે છે.	૬
૪	આક્ષેપ પુરવાર કરો યા મિચ્છામિ દુક્કડમ્ પાઠવો	૮
૫	કુમતિ ચાતુર્ય ક્યાં સુધી છુપૂ રહેશે ?	૧૧
૬	ક્યાં ગઈ શાસ્ત્રોની તારવણી ?	૧૩
૭	સંસ્કારના નામે કુસંસ્કાર એ શ્રમણાત્મમે કલંક છે.	૧૪
૮	પૂ. બાપળ મહારાજ માટે નિભન્કક્ષાનું લખાણ માત્ર કુલાંગારજ કરી શકે ૨૦	૨૦
૯	સંમેલનની મોટામાં મોટી નાલેશી	૨૪
૧૦	લેખકશ્રીની બન્ને માંગણીઓની પ્રતિતિ અમે કરાવી દઈએ છીએ	૨૮
૧૧	લેખકશ્રીને પ્રતિતિ કરવી જ હશે તો આ સુવર્ણ અવસર છે	૩૦
૧૨	તો પછી એ શાસ્ત્રપાઠ પુરવાર કરવાની જવાબદારી લેખકશ્રીની છે	૩૪
૧૩	સિદ્ધાંત મહોદધિની છાપ લેખકશ્રીએ ખાબોચિયા જેટલી કરી નાંખી.	૩૮
૧૪	પૂ.આ.ભ. લબ્ધસૂરીચરળ મહારાજનો પત્ર.	૪૦
૧૫	લેખકશ્રીના દંબનો પદ્ધકિશ.	૪૩
૧૬	પરિશિષ્ટ-૧ પૂ. બાપળ મહારાજનો તિથિ અંગે અગત્યનો ખુલાસો	૪૪
૧૭	પ્રશ્નોત્તરી	૪૮
૧૮	હીરપ્રશ્નોત્તર-તિથિ આચરણા છે તેમ ક્યાંય જણાવ્યું નથી.	૫૮
૧૯	આ તે કેવો ન્યાય ? લેખકશ્રીની ઉત્તાનમતિ !	૫૯
૨૦	સંધ-અવજા વિ.સં. ૨૦૪૪ના સંમેલનનેબંધ બેસતુ જણાય છે	૬૦
૨૧	પાસાત્થાનું લક્ષણ અને વિ.સં. ૨૦૪૪નું સંમેલન	૬૧

~~~~~

## આ સર્વજ્ઞાનું બંધારણ છે - ચણોડીની સરખામણી સોના સાથે ન થાય

લેખકશ્રી જણાવે છે કે,

‘કાયદાની કલમના અર્થઘટન વગેરેમાં જજની બેચમાં મતભેદ થાય તો બહુમતિ જજનો નિર્ણય માન્ય બને છે. તેમ માટે, શ્રી જૈન શાસનમાં ગીતાર્થોની સર્વાનુમતિ થાય તો પ્રથમ નંબર, નહીંતર ગીતાર્થોની બહુમતિ જ મહત્વની છે એ સ્પષ્ટ છે.’

અહીંયા લેખકશ્રી ચણોડીની સરખામણી સોના સાથે કરે છે તે અત્યંત દુઃખદ છે. કાયદાનું બંધારણ ઇન્દ્રસ્થોએ ઘડયું છે માટે તેમાં અવાર નવાર મતભેદ થાય તે સ્વાભાવિક છે. જ્યારે શાસ્ત્રો તો સંપૂર્ણ જ્ઞાનીના છે. બન્નેની સરખામણી કરવી તે તો મહાઅનર્થકારી છે. વિ.સં. ૨૦૪૪ના સંમેલનમાં આપણે જેઠ ગયા કે શાસ્ત્રમતિ ન હોવાથી સમગ્ર સંમેલન એ ભૂતકાળની અમંગળ ઘટના રૂપે બની ગયું. માટે જ નવોપક્ષ નહિ પણ શાસ્ત્રવફાદાર પક્ષ અને આજ સુધીના થયેલા મહાપુરુષો એકી અવાજે ફરમાવે છે કે શાસ્ત્રમતિનું જ મહત્વ છે. અરે ! કાયદાના બંધારણમાં પણ કાયદાને જ મહત્વ અપાય છે એકતાને નહિ જ.

ખાસનોંધ : લેખકશ્રી વાંચકોને ગુમરાહ કરવાના ઈરાદાથી જ્યાં જ્યાં ‘નવોપક્ષ’ સંબોધે છે ત્યાં ત્યાં ‘શાસ્ત્ર વફાદાર પક્ષ’ એમ સમજવું. શાસ્ત્રવફાદારપક્ષ એટલે પ્રાચિનતમ્ પક્ષ. અસ્તુ.

~~~~~ | ~~~~

॥ ણમોડત્થુણાં સમાણસ્સ ભગવાનો મહાવીરસ્સ ॥
 ॥ અનંત લબ્ધિનિધાન શ્રી ગૌતમસ્વામિને નમઃ ॥
 ॥ નમામિ નિત્યં ગુરુ રામચંદ્રમૃ ॥

પૂ.આ. અભયશોખરસૂરિ લિખિત પુસ્તક
‘તિથિ અંગે સત્ય અને સમાધાન’ (માગ-૨)
એક તટરસ્થ સમીક્ષા (માગ-૨)

વીતરાગ ! સપર્યાયા - સ્તવજ્ઞાપાલન પરમ ।
 આજ્ઞાઽરાદ્વા વિરાદ્વા ચ, શિવાયચ ભવાયચ ॥

અનંત ઉપકારી કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા વિતરાગ પરમાત્માની સ્તવના કરતા જણાવે છે કે, ‘હે પરમાત્મા ! તારી સેવા કરતા પણ તારી આજ્ઞાનું પાલન એજ તારી મોટામાં મોટી સેવા છે. કેમકે આરાધેલી આજ્ઞા મોક્ષ માટે થાય છે, જ્યારે વિરાધેલી આજ્ઞા સંસારને વધારે છે. આજ્ઞાનું જ મહત્વ છે માટે કોઈપણ આરાધના આજ્ઞાનુસાર થાય તેજ સૌ કોઈ માટે ઈચ્છનીય છે.

પ.પૂ.આ.ભ. અભયશોખરસૂરિ એ ‘તિથિ અંગે સત્ય અને સમાધાન’ પુસ્તક બહાર પાડેલુ. તે પુસ્તક અંગે મેં એક તટરસ્થ સમીક્ષા ઇપે પુસ્તક બહાર પાડેલુ. લેખકશ્રીના પુસ્તકનું લખાણ શાસ્ત્રાધાર વિનાનુ, સ્વમતિકલિપિત અને એકતાના નામે ભદ્રિક

જીવોને ગુમરાહ કરનાડું હોવાથી મારા પુસ્તકમાં શાસ્ત્રાધારો સાથે તટસ્થ સમીક્ષા કરવામાં આવી હતી. ત્યારબાદ લેખકશ્રીએ ‘તિથિ અંગે સત્ય અને સમાધાન ભાગ-૨’ નામનું પુસ્તક બહાર પાડ્યું છે. તે પ્રસ્તુત પુસ્તક ભાગ-૨માં કરેલા મારા લખાણના અંશો પુરતો તથા અન્ય જરૂરી ખુલાસો આ તટસ્થ સમીક્ષા ભાગ-૨માં મેં કર્યો છે. આ તટસ્થ સમીક્ષા જેમ જેમ વાંચવામાં આવશે તેમ તેમ પૂર્ણ ઉપાધ્યાયનું યશોવિજ્ઞયનું મહારાજાની પંક્તિ, ‘જિન વચન અન્યથા દાખવે આજતો વાજતે ઢોલ રે’ લેખકશ્રીના ભાગ-૨ અંગે છે તે અત્યંત સ્પષ્ટ થઈ જશે.

સૌ પ્રથમ તો લેખક પૂજયશ્રી દ્રવ્યસત્ય અને ભાવસત્યની તેઓશ્રીની સ્વમતિ કલ્પિત વ્યાખ્યા માટે આજ સુધી કોઈ જ શાસ્ત્રાધાર આપી શક્યા નથી. શાસ્ત્રાધાર ન હોવાથી તેઓશ્રીએ હરણીયા અને શિકારીનું દ્રષ્ટાંત આપવા દ્વારા દ્રવ્યસત્ય અને ભાવસત્ય સમજવવાનો નિરર્થક પ્રયત્ન કર્યો અને વિમાસણાભરી પરિસ્થિતિમાં મુકાબું પડ્યું. જેનો તેઓશ્રીએ તેમના પ્રસ્તુત પુસ્તક ભાગ-૨માં મને કમને સ્વીકાર કરવો પડ્યો. અધુરામાં પુરુ હોય તેમ તેઓશ્રી પ્રસ્તુત પુસ્તક ભાગ-૨ ના પૃષ્ઠ -૧ ઉપર જણાવે છે કે,

‘શ્રી સંધે ડેરવેલા એક દિવસે બધાએ આરાધના કરવી. આ તિથિ અંગેનું ભાવસત્ય છે. આવી તારવળી શાસ્ત્રપાઠ અને પૂર્વાચાર્યના સંદર્ભો વગેરે પરથી મેં ‘તિથિ અંગે સત્ય અને સમાધાન’ નામની પુસ્તિકામાં રજુ કરી છે.’

ઉપરોક્ત લખાણ લખવા છતાં અને તિથિ અંગેના દગ્ધાલાબંધ શાસ્ત્રપાઠો હોવા છતાં લેખકશ્રીના વિરુદ્ધમાં તે શાસ્ત્રપાઠો જતા હોવાથી તેઓશ્રીએ શાસ્ત્રપાઠો આપ્યા નથી. પૂર્વચાર્યના કોઈ જ સંદર્ભો આપ્યા નથી. ઉપરથી ‘ક્ષયેપૂર્વા’ જેવા ઉમાસ્વાતિ ભગવાનના પ્રધોષના ગંગીર શાસ્ત્રપાઠો અંગે, ‘આપણે તેના અર્થધટનમાં પડવું નથી’ (પૃષ્ઠ ૩ ભાગ-૧) તેમ લખીને શાસ્ત્રપાઠની ભારે ઉપેક્ષા કરી છે. ઉપરાંત તે ‘ક્ષયેપૂર્વા’નું સંપૂર્ણ અર્થધટન તેમના જ પ્રદાદાગુરુદેવ શ્રીમદ્ વિજય દાનસૂરીશ્વરજી મહારાજાએ તેમના જ દ્વારા થયેલા પ્રકાશનમાં આપેલું હોવા છતાં તે અર્થધટન સ્વીકારવાનો ધરાર ઈન્કાર કર્યો છે. જે તેમના જ દાદાગુરુદેવનું ‘ક્ષયેપૂર્વા’નું અર્થધટન જે તેમના જ પ્રકાશનમાં છે તેનો સ્વીકાર કર્યો હોત તો તેઓએ પણ તપસ્વીસગ્રાટ આ.ભ. હિમાંશુસૂરિ (જેઓશ્રીને, તેમનો સમુદ્દર્ય પોતાના ગરછના વડીલ આચાર્ય તરફે નામ લખતો હતો અને આ રીતે તેમના નામનો ઉપયોગ કરતો હતો પરંતુ જ્યારે સં. ૨૦૫૫ની સંવત્સરી તિથિની માન્યતામાં તેઓ પોતાના ગુરુઓની સાચી તિથિને વફાદાર રહ્યા એટલે તે પછી તેમનું નામ લખવાનાનું બંધ કર્યું તેમ જણાય છે.) એ જેમ વિ.સં. ૨૦૫૫માં પોતાના ગુરુ ભગવંતોને વફાદાર રહી સંવત્સરી મહાપર્વ ભા.સુ. ઉદ્ઘાત ૪ ના આરાધના કરી તેમ લેખકશ્રી પણ શુદ્ધ શાસ્ત્રીય સંવત્સરી મહાપર્વ ભા.સુ. ઉદ્ઘાત ૪ બુધવાર તા. ૭-૮-૦૫ના રોજ કરી-કરાવી પોતાના ગુરુભગવંતોની વફાદારી સાચવી શક્યા હોત.

વास्तवમां लेखकश्रीએ જે શાસ્ત્રપાઠોને આધારે તારવણી કરી તે શાસ્ત્રપાઠો આપવાની તેઓશ્રીની જવાબદારી હોવા છતાં તે આપ્યા નથી. લેખકશ્રીએ જે પૂર્વાચાર્યોના સંદર્ભો વિગેરે પરથી તારવણી કરી તે કોઈ પૂર્વાચાર્યોના નામ-શાસ્ત્રપાઠ-સંદર્ભો રજુ કર્યા નથી. આથી સ્વાભાવિક છે કે લેખકશ્રીનું ઉપરોક્ત લખાણ એ ભદ્રિક લુંબોને ભરમાવનારું અને ગુમરાહ કરનારું છે.

આ રહી શાસ્ત્રોની સાચી તારવણી

તિથિ અંગેના તપાગચ્છને માન્ય નીચેના શાસ્ત્રો જેવા કે, સ્થાનાંગસૂત્ર, સૂર્યપ્રશસ્તિ, ચંદ્રપ્રશસ્તિ, કલ્પસૂત્ર વગેરે આગમણ્યો, જ્યોતિષકરંડક, લોકપ્રકાશ, શાલ્વવિધિપ્રકરણમૃ, ધર્મસંગ્રહ, તત્ત્વતરંગિણિ, પ્રવચન પરીક્ષા, હીરપ્રશ્ન, સેનપ્રશ્ન, શ્રી પર્યુષણા સ્થિતિ વિચાર, સાધુમર્યાદા પઢુક, શ્રી કલ્પદીપિકા, કલ્પકૌમુદી, શ્રી પાક્ષિક પર્વસાર વિચાર, પ્રશસ્તિસંગ્રહ, શ્રી પ્રિયંકર નૃપ કથા, પર્યુષણ પર્વની તિથિનો વિચાર અને સંવત્સરી નિર્ણય વિગેરે એકી અવાજે સ્પષ્ટ જહેર કરે છે કે,

૧ ઉદયંમિ જા તિહિ સા પમાણમિઅરીઝ કીરમાણીએ
આણાભંગણવત્થા, મિચ્છત વિરાહણં પાવે ॥

અર્થ : સૂર્યોદય વખતે જે તિથિ હોય તે પ્રમાણ છે. બીજુ કરવામાં આવે તો તીર્થકરપ્રભુની આજ્ઞાનો ભંગ, અનવસ્થા મિથ્યાત્વ અને વિરાધના આ ચાર મહાદોષો લાગે છે.

૨ ક્ષયેપૂર્વા તિથિ કાર્યા, વૃદ્ધૌકગાર્યા તથોત્તરા ।

તિથિ (સર્વપર્વપર્વ)નો ક્ષય હોય તો તેની પૂર્વ તિથિમાં આરાધના કરવી. તિથિ ની વૃદ્ધિ હોય તો ઉત્તરની તિથિએ આરાધના કરવી (પૂ. ઉમાસ્વાતિ ભગવાનના પ્રધોષાનુસાર)

૩ જં જા જમ્મિ હું દિવસે, સમપ્પણ સા પમાળંતિ.

અર્થ : જે તિથિ જે દિવસે સમાપ્ત થાય તે પ્રમાણ ગણાય.

તો પછી તેનાથી વિપરિત પ્રડ્દપણા લેખકશ્રી કયા શાસ્ત્રોના આધારે અને પૂર્વાચાર્યોના સંદર્ભો ઉપરથી કરે છે ? તે સુઝ વાંચકોએ જ વિચારવું રહ્યું.

પૂ. આત્મારામજી મહારાજ, પૂ. બાપજી મહારાજ, પૂ. દ્વાનસૂરીશ્વરજી મહારાજ, પૂ. પ્રેમસૂરીશ્વરજી મહારાજ વિ. તમામ મહાપુરુષોએ પણ એકી અવાજે ઉપરોક્ત શાસ્ત્રપાઠાનુસાર ભાદરબા સુદુ ઉદ્યાત્ ચોથ આરાધી છે. તો લેખકશ્રીને પોતાના ગુરુદેવોની ઉજ્જવળ પરંપરાને છોડીને પ્રથમ પાંચમને કુન્તિમ ચોથ બનાવીને આરાધના કરવાની શી જરૂર પડી ? ઉદ્યાત્ ચોથ વિરાધવાની જરૂર શી પડી ?

લેખકશ્રીને ખાસ વિનંતી કરીએ છીએ કે પોતાની સ્વમતિ કલ્પિત વાતો ‘શ્રી સંઘના નામે’ ‘ગીતાર્થતાના નામે’ ચઢાવીને રજુઆત ન કરે.

પૂ.આ.ભ. દાનસૂરીશ્વરજી મહારાજનો પ્રાણશબ્દ 'સ્વમતિ' લેખકશ્રી દુરાદાપૂર્વક ઉડાવે છે.

લેખકશ્રી પ્રસ્તુત પુસ્તક ભાગ-૨ના પૃષ્ઠ ૩૦ ઉપર સ્વ.પૂ. દાનસૂરીશ્વરજી મહારાજ માટે લખે છે કે,

'પૂજયશ્રીનું જેર "કોઈપણ એક વ્યક્તિને ફેરફાર કરવાનો અધિકાર નથી...." વગેરે જેના પર હતું તેને કિરણભાઈ કેમ જણાવતા નથી ? (વિવિધ પ્રશ્નોત્તરનું લખાણ પૂર્વે પૃ.૧૮ ઉપર આપેલું છે)'

હવે લેખકશ્રીના જ પૃષ્ઠ ૧૮ ઉપર

'જુઓ શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ પ્રકાશિત વિવિધ પ્રશ્નોત્તરપાનું ૩૪૬ ઉપર તેઓઓએ જણાવ્યું છે કે 'કોઈપણ એક મનુષ્ય સ્વમતિથી જો કોઈપણ નવો ફેરફાર કે ગરેડ પાડવા માંગે તો તેમ કરવાનો હક તેને શ્રી સંઘ અને શાસનની પ્રણાલિકા બિલકુલ આપી શકતી નથી જ'

સુધી વાંચકોને ઘ્યાલ આવશે કે પ.પૂ.આ.ભ. દાનસૂરીશ્વરજી મ.સા. નો સૌથી મહત્વનો શબ્દ 'સ્વમતિથી' લેખકશ્રીએ પૃષ્ઠ ૩૦ ઉપર ઉડાવી દીધો છે. પ.પૂ.આ.ભ. દાનસૂરીશ્વરજી મ.સા. બહુજ સ્પષ્ટ માનતા જ્ઞા કે કોઈપણ એક વ્યક્તિને કે, ગમે તેટલી મોટી બહુમતિ હોય કે, સર્વમતિ હોય, સ્વમતિથી કોઈને પણ ફેરફાર કરવાનો અધિકાર નથી. એકમાત્ર શાસ્ત્રમતિનું જ જૈન શાસનમાં મહત્વ છે. માટે જ શાસ્ત્રકારોએ નીચેના શાસ્ત્રપાઠો આપ્યા છે.

एकोऽपि शास्त्र नीत्या यो, वर्तते स महाजनः ।
पिमङ्गसार्थः ९ शतमप्यन्धानां नैव पश्यति

‘शास्त्रने अनुसारे वर्तन करनार एक पुरुष होय तो पण ते
महाजन ज छે. भेगा थयेला अनेक ज्ञानो पण जे अज्ञानी होय
तो ते जेम सेंકडो आंधणाओ भेगा थाय तो पण जेठ शक्ता
नथी तेम वस्तुने यथार्थ जाणी शक्ता नथी’

(योगविंशिकानी टीकामां पू. उपा. यशोविजयल म.)

आજ वात पू. पं. चंद्रशेखर विजयल म. तेओश्रीना पुस्तક
'संसार'मां जणावे छे,

‘जमानोबहुभृतिनी तरफेण करनारो भले होय पण श्री
जिनशासन तो जिनभृतिमां ज माने छे. भले पछी तेनी तरफेणमां
एक ज व्यक्ति होय.’

“श्री जिनशासनमां शांतिना लोगे पण जिनभृति-सत्यनी
रक्षा करवानी छे. सत्यना लोगे सहुभृति-शांतिनी नहि ज. एम
थाय तो शांतिनो विजय थाय, सत्यनो पराजय थाय. सत्य करता
शांतिनी किंभूत वधी जय. सत्यनो लोग एटले जिनभृतिनो लोग.”

वणी लेखकश्री जणावे छे के

‘तेओश्रीએ क्यारेय संघर्थी अलग पडीने आराधना करी
नहोती’

અમે પણ લેખકશ્રીને તેજ પૂછીએ છીએ કે સ્વ.પૂ.આ. દાનસૂરીશ્વરજી મહારાજાએ લેખકશ્રીની જેમ કયારેય ઉદ્ઘાત ચોથ વિરાધી નથી. અરે ! લેખકશ્રી પોતાના દાદાગુરુદેવો પૂ. આત્મારામજી મહારાજાની ઉજળી પરંપરા (જે લેખકશ્રીએ છોડી દીધી)માં કોઈએ પણ ભા.સુ. ઉદ્ઘાત ચોથ વિરોધી હોય તો પુરવાર કરે, કોઈએ પણ પ્રથમ પાંચમ ને કુન્તિમ ચોથ બનાવી આરાધી હોય તો પુરવાર કરે અન્યથા ગુરુદ્રોહના અંશથી પણ બચી શકાય તેમ નથી જ. બાકી તો બધા જ મહત્વ આપે છે કે આખા સંઘની આરાધના એક દિવસે જ થાય પણ લેખકશ્રીએ એમાં આરાધના શાસ્ત્રવાધારે એક દિવસે જ થાય તેમ લખવું જોઈતું હતું. તો શાસ્ત્રવક્ષાદારોને કાંઈ વાંધો છે જ નહિ.

આક્ષેપ પુરવાર કરો યા મિચછામિ દુક્કડમ્ પાઠવો.

હવે તેજ પ્રસ્તુત પુસ્તક ભાગ-૨ના પૃષ્ઠ ૩૦ ઉપર લેખકશ્રી જણાવે છે કે

‘સ્વ.પૂ.આ.શ્રી પ્રેમસૂરીશ્વરજી મહારાજાએ સંઘથી અલગ જે આરાધના કરી એનું મિચછામિ દુક્કડમ્ આપ્યું છે.’

અમને ખૂબ જ દુઃખ સાથે જણાવવું પડે છે કે લેખકશ્રીએ પોતાના પરમગુરુદાદાશ્રી પ્રેમસૂરીશ્વરજી મ. માટે ઉપરોક્ત લખાણ લખ્યું છે તે જાણી કોઈપણ મધ્યસ્થ વ્યક્તિ કહી શકશે કે આ તેમના શિષ્યત્વને કલંક છે.

લેખકશ્રીને અમે જહેરમાં વિનંતી કરીએ છીએ કે સ્વ. પૂ. આચાર્યદિવ શ્રીમહા વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજાએ ભિન્ધામિ દુક્કડમ્ આપ્યું તે નક્કરપુરાવાઓ સાથે પુરવાર કરો અને શિષ્યત્વના કલંકને દૂર કરો.

- ૧ સ્વ. પૂ. આ. ભગવંત પ્રેમસૂરિ મ. નો ભિન્ધામિ દુક્કડમ્નો પત્ર નક્કરપુરાવાઓ સાથે પુરવાર કરો.
- ૨ સ્વ. પૂ. આ. ભગવંતે તે પ્રાયસ્થિત કયારે કર્યું ?
- ૩ તે પ્રાયસ્થિતનો પત્ર આપના કયા કયા પ્રકારણમાં આવ્યો ?
- ૪ પ્રાયસ્થિત શા માટે કર્યું ?
- ૫ એક બાજુ પૂ. આ. પ્રેમસૂરિ મ. ના નક્કર પુરાવાઓના લખાણો જે લેખકશ્રીના જ પ્રકારણનો, 'દિવ્યદર્શન,' 'સંભારણા સુરિ પ્રેમના' વિ. નામાં સુશા વાંચકો વિશ્વાસ મુક્શે કે કોઈપણ નક્કર પુરાવા વિનાના શિષ્યત્વને કલંકિત કરનારા લેખકશ્રીના નિભન્કક્ષાના લખાણો ઉપર ?
- ૬ સ્વ. પૂ. આ. ભ. પ્રેમસૂરિ મ. એ ભિન્ધામિ દુક્કડમ્ કર્યું ત્યારે ઉપસ્થિતિ કોની કોની હતી ?
- ૭ વિ. સં. ૨૦૨૦ના અપવાદિક આચરણા રૂપ પદૃકમાં પ્રાયસ્થિતનો ઉલ્લેખ સુદ્ધાં કેમ ન કર્યો ?
- ૮ જે પ્રાયસ્થિત જ કર્યું તો તેથી વિપરીત એવો વિ. સં. ૨૦૨૦નો પદૃક કેમ દૂર ન કર્યો ?

૯ સ્વ. પૂ. આ. ગ્રેમસૂરિ મ. એ વિ. સં. ૨૦૨૦ના પછુક બાદ
પ્રાયશ્ચિત કર્યું કે પહેલાં કર્યું ?

૧૦ પૂ. આ. ગ્રેમસૂરિ મ. ના કાળઘર્મ બાદ (વિ. સં. ૨૦૨૪થી
વિ. સં. ૨૦૪૨ સુધી) તમે પણ તમારા કહેવાતા સંધથી અલગ
આરાધના કરી તેનું અત્યાર સુધી પ્રાયશ્ચિત કેમ ન કર્યું ?
વધુમાં લેખકશ્રી પૃષ્ઠ ૩૦ ઉપર જણાવે છે કે,

‘દિવ્યદર્શનના ૨-૬-૧૯૬૨ના અંકમાંથી સ્વ. પૂ. ગ્રેમસૂરીશ્વરજી
મ. સા. ના નિવેદનની જે અધૂરી પંક્તિ રજુ કરી છે તેની જોડેની જ પંક્તિ
આ પ્રમાણે છે, ‘પરંતુ સકળ સંધના ઐક્યની આવશ્યકતા સહુ કોઈ જાણે
છે’ લેખકે આ અંશ છૂપાવવો પડ્યો કારણે આ અંશથી ભાવસત્યની
મહત્તમા સ્થાપિત થાય છે.’

તેની સામે જણાવવાનું કે અમને કંઈ જ છૂપાવવાની જરૂર
નથી. અમે તિથિ અંગેનું પૂર્વાપર સંબંધવાળું લખાણ દિવ્યદર્શનનું
અતે આપીએ છીએ અને મદ્યસ્થ બુદ્ધિએ નિર્ણય લેવાનું સુઝ
વાંચકો ઉપર છોડીએ છીએ.

“તિથિ ચર્ચા બાબતમાં તિથિ આપણી જ સાચી છે તેમાં
શંકા નથી. પરંતુ સકળ સંધની ઐક્યની આવશ્યકતા સૌ કોઈ જાણે
છે તેથી કોઈ વખતે કદાચ વિચારવાનો પ્રસંગ જિલ્લો થાય તો તે
વખતે હું આચાર્ય રામચંદ્રસૂરીશ્વરજીની સલાહ સંમતિથી કરવાનો
ઇન્દ્ર”

કુમતિ ચાતુર્ય ક્યાં સુધી છુપુ રહેશે ?

વધુમાં લેખકશ્રી પૃષ્ઠ ૩૧ ઉપર જણાવે છે કે,

‘સંભારણા સુરિપ્રેમના ગ્રંથમાંથી લેખકે જે પંક્તિઓ છાપી છે..તથા ‘આ ચૂકાદાને માન્ય કરવામાં ન આવ્યો’ એવી જે પંક્તિ તેઓએ ઉદ્ઘૃત કરી તેનાથી પણ સૂચિત થાય છે કે શ્રી તપાગરછ જૈન સંદે ભાગલાવાદને ઉત્તેજન આપ્યું નથી’

લેખકશ્રી તેઓના જ પ્રકારાનનું લખાણ, શ્રી વિજય રામચંદ્રસૂરિલુનો પક્ષ જ સત્ય છે. ‘પણ લેખિત રીતે કબૂલ થવા છતાં સામા પક્ષ તરફથી આ ચૂકાદાને માન્ય કરવામાં ન આવ્યો’ આમાંથી લેખકશ્રીએ,

‘પણ લેખિત રીતે કબૂલ થવા છતાં સામાપક્ષ તરફથી’

શબ્દો પોતાના પ્રસ્તુત પુસ્તક ભાગ-૨માં ઈરાદાપૂર્વક ઉડાવી દીધા છે અને માત્ર ‘આ ચૂકાદાને માન્ય કરવામાં ન આવ્યો’

તેમ લખી જણે આ ચૂકાદો સમગ્ર તપાગરછ સંદે અમાન્ય કર્યો હોય તેવી આભા ઊભી કરવાનો એક ફરી નિઝનકષાનો પ્રયત્ન કર્યો છે. વાસ્તવમાં સાગરણ મહારાજાએ લેખિત કબુલાત આપીને ચૂકાદો ના કબૂલ કર્યો હતો.

સુજા વાંચકોને ઘ્યાલ છે કે બન્ને આચાર્ય ભગવંતો પૂ. સાગરણ મહારાજ અને પૂ. રામચંદ્રસૂરીશ્વરણ મહારાજાએ શેઠશ્રી કસ્તુરભાઈ લાલભાઈની દરમ્યાનગિરી દ્વારા વિદ્ધાન મધ્યસ્થ પંચ નો નિર્ણય બન્નેને માન્ય રહેશે તેવી લેખિત કબુલાત કરેલી.

લેખકશ્રીના જ પ્રકાશનમાં તેઓએ જણાવ્યું છે કે (પૃષ્ઠ-૨૮) શ્રી વૈદ્ય બધુ સાહિત્ય તપાસીને કહ્યું, ‘આમાં પૂ. આ. શ્રી સાગરાનંદસૂરિજી મ. તરફથી એમના મંતવ્યના શાસ્ત્રપાઠોની કેટલીક પ્રામાણિક મૂળ હસ્તલિખિત પ્રતિ મળી નથી.’

લેખકશ્રી ખૂદ પોતાના પ્રકાશનમાં આટલું સ્પષ્ટ લખવા છતાં અને સાગરજી મહારાજના વિરુદ્ધમાં ચૂકાદો આવ્યો માટે તેમને અમાન્ય કર્યો ત્યારે કસ્તુરભાઈને નીચે મુજબ દુઃખ નિવેદન આપવું પડ્યું,

‘ફક્ત મમત્વને વશ થઈ મતાગ્રહ બંધાતા વિદ્ધાન આચાર્ય પોતાની લેખિત કબુલાત ના કબુલ કરે છે અને એક સજજન અને વિદ્ધાન પંચ સામે ગમે તેવો પ્રચાર આપ્યે છે તે યોગ્ય નથી.’

ખૂદ શેઠશ્રી કસ્તુરભાઈએ તટસ્થ નિવેદન આપ્યું જ્યારે લેખકશ્રી શેઠશ્રી કસ્તુરભાઈ કરતાં ઘણાં ગૌરવભર્યા સ્થાને બિરાજમાન હોવા છતાં સુજા વાચકોને કેવા ગેરમાર્ગ દોરે છે તે અત્યંત સ્પષ્ટ થઈ જાય છે. પ્રસંગ એક જ છે. એક બાજુ શેઠશ્રી કસ્તુરભાઈનું સત્વરાણી વાસ્તવિક સત્ય સ્વરૂપ નિવેદન છે. અને બીજુ બાજુ તેજ પ્રસંગને પામીને આચાર્યપદના ગૌરવને ડાધ લાગે તેવું લેખકશ્રી નું નિઝક્ષાનું નિવેદન છે. લેખકશ્રીનો વિશ્વાસ ક્યાં કરવો? આટલી નિઝ કક્ષાની ખુશામત તો આજ સુધી કોઈએ કરી હોય તેવું જણાતું નથી. લેખકશ્રીની કુમતિ કેટલી હુદે જઈ શકે છે તે સુજા વાંચકો સમજુ શકે છે. આ વાંચતા પૂ. ઉપા. યશોવિજયજી મહારાજની પંક્તિઓ યાદ આવે છે.

‘યોગ્ય અયોગ્ય વિભાગ અલહૃતો કરશે મોટી વાતોળું;
 ‘ખમશે તે પંડિત પરિષદમાં મુચ્છિપ્રહારને લાતોળું.’

(યોગદ્રષ્ટિની સજ્જાય) - અસ્તુ.

કયાં ગઈ શાસ્ત્રોની તારવણી ?

વધુમાં પૃષ્ઠ-૩૧ ઉપર લેખકશ્રી મારા માટે જણાવે છે કે,

‘લેખકે (એટલે મેં) પૃ. ૬ ઉપર મેં (પ્રસ્તુત ભાગ-૨ લેખકશ્રી) વાપરેલા અમુક શબ્દની જે ટીકા કરી છે તે અણસમજની પેદાશ છે, એવું સામાન્ય બૃદ્ધિ ઘરાવનાર વાંચકોને પણ મારું લખાણ વાંચતા આવી જય એમ છે, કારણકે તિથિ અંગે આપણા શાસ્ત્રોએ જે નિઝપણ કર્યું છે એના કરતા લૌકિક પંચાંગની તિથિઓ અલગ પડી જય છે. આટલું જ જણાવવાનો ત્યાં અભિપ્રાય છે. પછી અમુક તિથિ તરીકે કઈ કઈ તિથિ આવે છે એ વિસ્તારની આવશ્યકતા નથી.’

આ અંગે જણાવવાનું કે, ‘વૃદ્ધિ તિથિ હોય તો શાસ્ત્રપાઠો સાથે જહેર કરે’ તેમ સામાપ્નને હુંકારપૂર્વક પ્રશ્ન પુછનારા લેખકશ્રી પર્વતિથિનો પણ ક્ષય આવે છે તેમ પ્રમાણિકપણે નિષ્ઠાપૂર્વક સ્વીકારવામાં શા માટે પારોઠના પગલા ભરે છે ? અમારો લેખકશ્રીને જહેરમાં આગ્રહ છે કે, સિદ્ધાંત રિપ્પણામાં પર્વતિથિનો ક્ષય નથી આવતો તો તે શાસ્ત્રપાઠો સાથે જહેર કરો. એક તિથિ પક્ષે સામે ચાલીને ગયા છો માટે કદાચ તે પક્ષની ખફા વહોરવાના પ્રસંગથી નભળાઈ છૂપાવવા શબ્દોની માયાજળ રચવી તે કેટલે અંશો યોગ્ય

છે તે સામાન્યબુદ્ધિ ઘરાવનાર વાંચકો પણ અત્યંત સહેલાઈથી સમજ શકે છે. સુજા વાંચકો જ લેખકશ્રીને પ્રશ્ન કરશે કે, ‘ક્યાં ગઈ તમારી શાસ્ત્રોની તારવણી ? પર્વતિથિનો પણ ક્ષય આવે છે તે સરળતાપૂર્વક સ્વીકારવામાં ક્યાં વિસ્તાર થઈ જવાનો હતો ?’ પણ સામે ચાલીને સામા પક્ષે જવાથી હવે આ ‘અહોરૂં અહોધ્વનિ’નો આલાપ બંધ કરાવવો બહુજ કઠિન છે. લેખકશ્રી આ ખુશામત બંધ કરી શાસ્ત્રપાઠો જાહેર કરે.

સંસ્કારના નામે કુસંસ્કાર એ શ્રમણત્વને કલંક છે

લેખકશ્રી પૃષ્ઠ ૩૧ ઉપર જણાવે છે કે,

‘એકતા ઉદ્ઘાત ચોથની હોય કે પ્રથમ પાંચમ ફલ્ગુતિથિની ? સમજણ વગર જ પ્રશ્ન લેખકે ઊભો કર્યો છે. કારણકે જૈન શાસ્ત્ર અનુસાર કોઈ ફલ્ગુતિથિ-નપુંસક તિથિ હોતી જ નથી. અને વર્તમાન શ્રી સંધ આરાધના માટે જે પંચાંગ પ્રકાશિત કરે છે એમાં પાંચમ બે હોતી જ નથી એટલે પ્રથમ પાંચમ-ફલ્ગુતિથિ..... વગેરે શાબ્દો માત્ર ભમણા સિવાય બીજુ કશું નથી. લૌકિક પંચાગને વગર સંસ્કારે માની લીધુ એ જૈનત્વનું કલંક છે.’

આ વાતની સામે નીચેના શાસ્ત્રપાઠો તથા શાસ્ત્રાનુસારી મંતવ્યો અમે રજુ કરીએ છીએ જેથી સુજા વાંચકોને ખ્યાલ આવશે કે વાસ્તવમાં લેખકશ્રીજ હજુ ભમણના વમણમાં જ છે.

૧. પૂ. સાગરણ મહારાજનું શાસ્ત્રાનુસારી મંતવ્ય

પ્રશ્ન ૮૩૮-બીજ, પાંચમ આદિનો ક્ષય અને વૃદ્ધિ શ્રી જૈન

શાસ્ત્ર પ્રમાણે હોય કે નહિ ?

સમાધાન : શ્રી સ્થાનાંગ સૂત્ર તથા સૂર્ય પ્રજાપ્તિ આદિ સુત્રો અને જ્યોતિષ કરંડક આદિ પ્રકરણોને અનુસારે સાફ્ સાફ્ જણાય છે કે બીજ, પાંચમ આદિ પર્વતિથિઓનો ક્ષય હોઈ શકે છે, પણ તિથિઓની વૃદ્ધિ થવાનો પ્રસંગ ઓછો છે. છતાં ક્ષય અને વૃદ્ધિના પ્રસંગો નિયત છે. (સિદ્ધયક વર્ષ-૫ અંક-૨ પૃ-૭)

૨. શ્રી કલ્પસૂત્રના નવમા વ્યાખ્યાનમાં આ અંગે સ્પષ્ટ ઉલ્લેખ મળે છે.

...ભાદ્રપદવૃદ્ધૌ પ્રથમો ભાદ્રપદોऽપિ અપ્રમાણમેવ,
યથા ચતુર્દશી વૃદ્ધૌ પ્રથમાં ચતુર્દશીમવગળ્ય દ્વિતીયાયાં
ચતુર્દશ્યાં પાક્ષિકકૃત્યં ક્રિયતે તથાઽત્રાપિ

અર્થ : ભાદ્રવા મહિનાની વૃદ્ધિ આવે ત્યારે પ્રથમ ભાદ્રવો અપ્રમાણ જ છે, જેમ ચૌદશની વૃદ્ધિ આવે ત્યારે પહેલી ચૌદશની અવગણના કરીને બીજી ચૌદશો પ્રતિક્રમણ કરાય છે, તેમ અહીં પણા.

શ્રી કલ્પસૂત્રની આ ટીકામાં પહેલી ચૌદશની અવગણના કરવાનું જણાવ્યું છે, જ્યારે લેખકશ્રીના કહેવા મુજબ નયું સક્તિથિ હોતી જ નથી-તે વાતને કોઈ મેળ જ નથી. વળી તે વખતે પણ બે ચૌદશ જ કરાતી હતી. બે ચૌદશની બે તેરસ નહોતી કરાતી પણ બે ચૌદશને યથાવત રાખી બીજી ચૌદશો પદ્ધભીનું કાર્ય કરાતું

~~~~~  
હતું. લેખકશ્રી તો શ્રી કલ્પસૂત્રના ટીકીકારને જૈનત્વનું કલંક લગાડશે  
તો નવાઈ નહિ !

બે ચૌદસ હોથ તો પહેલી ચૌદસને તેરસ બનાવવાના સંસ્કાર  
પૂ. મહામહોપાદ્યાય વિનય વિજયજી મહારાજને યોગ્ય ન લાગ્યા  
અને લેખકશ્રી હવે તે સંસ્કાર સ્વમતિ કલ્પિત રીતે કરી રહ્યા છે !  
શ્રી કલ્પસૂત્રથી ઉપરવટ જવાનો કોઈને પણ અધિકાર નથી.

3. સ્વ.આ.ભ. પ્રેમસૂરીશ્વરજી મહારાજનો પદ્ધતિ વિ.સ.  
૨૦૨૦

‘તિથિદિન અને પર્વારાધન બાબતમાં શ્રી સંઘમાન્ય  
પંચાંગમાં બતાવેલી સર્વ પર્વપર્વ તિથિઓની ક્ષયવૃદ્ધિ યથાવત्  
માન્ય રાખીને આપણે જે રીતે ‘ઉદ્યમિ’ તથા ‘ક્ષયેપૂર્વા’ના નિયમ  
અનુસાર તિથિદિન અને આરાધના દિન નક્કી કરીએ છીએ તે  
શાસ્ત્રાનુસારી છે, તેમજ શાસ્ત્રમાન્ય પ્રાચીન પરંપરાનુસારી છે.  
લવાદી ચર્ચામાં તેવા પ્રકારનો નિર્ણય આવી જ ગયો છે.’ ‘માટે  
શ્રી સંઘમાન્ય પંચાંગમાં જ્યારે જ્યારે ભાદરવા સુદી પની ક્ષયવૃદ્ધિ  
આવે ત્યારે ત્યારે તે ક્ષયવૃદ્ધિ કાયમ રાખી તે જ પંચાંગની ઉદ્યાત  
ભાદરવા સુદી ચોથે શ્રી સંવત્સરી કરવાની અને તેજ પ્રમાણે બાકીની  
૧૨ પર્વીમાંની તિથિઓ તથા કલ્યાણકાહિની સર્વ તિથિઓ પણ  
પંચાંગમાં બતાવ્યા મુજબ માન્ય રાખીને જ આરાધના કરવાની’

આ મુજબ પોતાના જ પ્રદાદાગુરુદેવ સ્વ.આ.દેવ પ્રેમસૂરીશ્વરજી મહારાજ જ્યારે બે પાંચમ નો સ્પષ્ટ ઉલ્લેખ કરે છે ત્યારે તેમાં કુસંસ્કાર કરવા તે શ્રમણત્વને અને શિષ્યત્વને કલંક છે. તેમ કોઈપણ તટસ્થ વ્યક્તિ કહ્યા વગર નહિ રહે.

૪. અરે ! ખુદ જેના શિલાન્યાસ અને ખાત મૂર્હીત પ્રસંગે સ્વ.પૂ.આ.ભ. ભુવનભાનુસૂરિ એ નિશ્ચા પ્રદાન કરેલી તેવા મદ્રાસના પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે એક તિથિ પક્ષે બે ચૌદસનો કરેલો ઉલ્લેખ

સાતમી નેવેદ્ય પુનસે અણાહારી પદ હેતુ સાતવાઁ દિન વિ.સં. ૨૦૫૨ જ્યેષ્ઠ વદ ૧૪ ગુરુવાર દિનાંક ૧૬-૫-૬૬

અષ્ટમી ગતિ પ્રાપ્ત કર્ને હેતુ આઠવા દિન વિ.સં. ૨૦૫૨ જ્યેષ્ઠ વદ ૧૪ શુક્રવાર દિનાંક ૧૭-૫-૬૬ નિમંત્રક : શ્રી જૈન સંઘ ટ્રેસ્ટ, ૨, મદ્ન નારાયણ સ્ટ્રીટ, મૈલાપુર, મદ્રાસ - ૬૦૦ ૦૦૪.

લૌકિક પંચાંગને વગર સંસ્કારે માની લેવુ તે જૈનત્વનું કલંક છે તેમ કહેનારા લેખકશ્રી ઉપર મુજબ એક તિથિ પક્ષે કરેલા બે ચૌદસના ઉલ્લેખને (સંસ્કાર ન કર્યા માટે) કયું કલંક કહેશે ? કે પછી બચાવ કરશે ? આતો કૃષણ કરે તે લીલા, બીજ કરે તે છીનાણું જેવો ધાર થયો !

સુજા વાંચકો ! આપજ સમજુ શકશો કે લેખકશ્રી આ બળતા ધરને કયાં સુધી બચાવશે ? અત્યારે તો તે બળતા ધરની જવાણાઓ ખૂદ લેખકશ્રીને જ દાડી રહી છે અને જળનો જોગ

જે જિજાસુઓ ને નહિ મળે તો તેઓ પણ દાઝયા વિના નહિ રહે તેજ માત્ર એકાંતે શુભભાવથી ઉપરનો અંગુલી નિર્દેશ કર્યો છે.

વળી લેખકશ્રી જ્યારે એમ જણાવે છે કે જૈન શાસ્ત્રોમાં વૃદ્ધિ તિથિ આવતી નથી તો જૈન શાસ્ત્રો પ્રમાણે,

- ૧ દર એકસઠમી તિથિએ બાસઠમી તિથિનો ક્ષય આવે છે તો લેખકશ્રી કેમ તે પ્રમાણે સંસ્કાર કરતા નથી ?
- ૨ જૈન શાસ્ત્રો પ્રમાણે તો એક યુગમાં એટલે પાંચવર્ષમાં પોષ અને અષાઢ માસની જ વૃદ્ધિ આવે છે તો લેખકશ્રી બીજા પણ મહિનાઓની વૃદ્ધિ શા માટે સ્વીકારે છે ?
- ૩ જૈન શાસ્ત્રો પ્રમાણે તો કોઈપણ માસનો ક્ષય હોતો નથી તો વિ.સં. ૨૦૨૦માં માગસર માસનો ક્ષય કેમ સ્વીકારેલો ?
- ૪ અધિક માસને નપુંસક માસ ગણશો કે તેમાં પણ પ્રતિષ્ઠા વિ. કર્યો કરશો ?

જેમ સિદ્ધાંત રિપણામાં ઉપરની કોઈ વાત નથી છતાં લૌકિક પંચાંગમાં સ્વીકારો છો તો પઈ પર્વતિથિની ક્ષયવૃદ્ધિ યથાવતું સ્વીકારવામાં વાંધો કર્યાં છે ? જે લેખકશ્રી પણ પહેલાં સ્વીકારતા હતા. ઉપરથી પોતાના દાદાગુરુભગવંતોની વકાદારી પણ સચ્યવાશે અને ગુરુદ્રોહનો અંશ બિલકુલ લાગશે નહિ.

વાસ્તવમાં લેખકશ્રીને વિ.સં. ૨૦૧૪ના સમસ્ત તપાગચ્છ

સંધે પંચાંગ અંગે લિધેલ નિર્ણય સ્વીકારવો નથી અને 'શ્રીસંધ'ના નામે પોતાની સ્વમતિ કલ્પિત વાતો દ્વારા ભદ્રિક જીવોને ગુમરાહ કરવા છે તે એકદમ સ્પષ્ટ થઇ જય છે.

લેખકશ્રી પૂજી. ઉપર જણાવે છે કે,

'પૂ. ૬ ઉપર પૂ. આત્મારામજી મ. ના નામે જે વાત કરી છે તે પણ તથ્યહીન છે. આ વાત જૈન ધર્મ પ્રકાશના વિ.સં. ૧૯૫૨ના શ્રાવણ માસના અંકમાં આવેલા "સંવત્સરી નિર્ણય" નામનો લેખ વાંચવાથી જણાશે. તા. ૨૧-૭-૩૭ના વીર શાસનમાં પણ સ્વ.પૂ.દાન સૂ.મ.સા.એ ૧૯૫૨માં ભા.સુ.પનો નહિપણ છઠનો જ ક્ષય મનાયેલો તે વાત જણાવી છે.'

પૂ. આત્મારામજી મહારાજની હ્યાતીમાં જ વૈન ધર્મ પ્રકાશ'ના પંચાંગમાં ભા.સુ.પનો ક્ષય યથાવત્ત માન્ય રાખી ૪+૫ શુક સંવત્સરી તે પ્રમાણે જણાવેલ છે.

ઉપરાંત પૂ.આ.ભ. દાન સૂ.મ. એ પાંચમના ક્ષયે ત્રીજનો ક્ષય કરવાનું ન કહ્યું તે યોગ્ય જ કર્યું તે લેખકશ્રીને મંજુર છે ?

વળી પૂ.આ.ભ. દાન સૂ.મ.એ ભાદ્રવા સુદ ઉદ્યાત્ ચોથ વિરાધી હોય તેવું ક્યારેય બન્યું છે ખરું ?

સ્વ.પૂ.આ.ભ. દાનસૂરીશ્વરજી મહારાજએ ઉદ્યાત્ ચોથ તો ક્યારેય વિરાધી નથી. અને ભા.સુ.પના ક્ષયે ફઠના ક્ષય અંગે પણ જ્યારે પૂ. બાપજી મહારાજએ જણાવ્યું કે આ ખોટું છે ત્યારે તેઓશ્રીએ તે પણ સુધારી લેશું તેમ જણાવેલું. લેખકશ્રીએ તો

ઉદ્યાત् ચોથ પણ વિરાધી છે અને પાંચમના ક્ષયે શું કરવું તેની આગોતરી નિષ્ઠાની જહેરાતના પણ વાંધા છે.

વળી લેખકશ્રીને પૂ.આ.ભ. દાન સ્વ.મ.નું તેમના જ પ્રકાશન 'વિવિધ પ્રજ્ઞોત્તર'નું પૃષ્ઠ ઉત્તલ્લી ઉદ્ઘાણ મંજુર છે ખરું ? તો પછી લેખકશ્રીને ઉદ્યાત् ચોથ વિરાધવાની જડૃ શી પડી ?

## પૂ. બાપણ મહારાજ માટે નિમ્નકક્ષાનું લખાણ માત્ર કુલાંગારજ કરી શકે

લેખકશ્રી પૃષ્ઠ ઉર ઉપર જણાવે છે કે,

'લેખકે પૂ. બાપણ મ. નો જે ખુલાસો ટાંક્યો છે એને ખુદ બાપણ મ. પણ મિથ્યા સમજતા હતા, એટલે કે એ ખુલાસાને વળી ખુલાસો ન કરવો પડે એ માટે ૨૦૧૪ની સંમેતનમાં મંગળાચરણ કરીને તેઓ તરત જ ઉપાશ્રેય પદ્ધારી ગયા હતા, અને પછી એકપણ દિવસ પદ્ધાર્યા નહોતા. આવું તત્કાલીન મહાત્માઓ જણાવે છે. વળી પૂ. લબ્ધિસૂરિ મ. સાહેબે વિ.સં. ૨૦૦૧ના દ્વિતીય ચૈત્ર સુદ-૧૩ પાલીતાણા શાન્તિભુવનથી તેઓશ્રીને લખેલા પત્રમાં પુનમ/અમાસની ક્ષય-વૃદ્ધિ બાબતમાં પ્રજ્ઞ પૂછાવેલો ત્યારે પૂજ્યશ્રીએ (બાપણ મહારાજે) અમદાવાદથી વિ.સં. ૨૦૦૧ ચૈત્ર વદ ૬ ના રોજ પત્ર લખીને જવાબ આપેલો કે "પૂર્ણિમાના ક્ષયે તથા વૃદ્ધિએ તેરસના ક્ષય અને વૃદ્ધિ ન કરવી - તે પંચાંગને પાને ચઢાવવા માટે અમો કંઈ પણ જાણતા નથી. તેમજ અમારી સંમતિ પણ નથી" તથા જે મહાત્માએ પૂ. બાપણ મ. પાસે કહેવાતો ખુલાસો દખાણ

પૂર્વક કરાવીને છપાવેલો તે મહાત્માએ તેના માટે ભારપૂર્વક અફ્સોસ વ્યક્તિ કરીને પ્રાયસ્થિત પણ લીધેલું છે. એટલે પૂ. બાપણ મ.ના આ કહેવાતા ખુલાસામાં વાસ્તવિકતા શું છે ? એ સમજ શક્ય એમ છે.'

સુશ વાંચકો જ લેખકશ્રીને પ્રશ્ન કરશે કે અમારે પૂ. બાપણ મહારાજના જહેર ખુલાસા, જહેર નિવેદનો વર્ષો પૂર્વે સત્તાવાર રીતે પ્રગટ થયા છે તે માનવા કે તમારા આવા નિભન્કક્ષાના પ્રયત્નોમાં સાથ પુરાવવો ?

### આક્ષેપ પુરવાર કરો અથવા મિચ્છામિ દુક્કડમ્ પાઠવો

અમારો લેખકશ્રીને જહેર પડકાર છે કે પૂ. બાપણ મહારાજ માટે જે નિભન્કક્ષાના આરોપો મુક્યા છે તે નક્કર પુરાવાઓ સાથે જહેર કરે, જે તત્કાલિન મહાત્માઓ હોય તેમના નિવેદનો સાથે નામ જહેર કરે અને જે મહાત્માએ દબાણપૂર્વક ખુલાસો પૂ. બાપણ મહારાજ પાસે કરાવ્યો તે મહાત્માનું નામ યોગ્ય નક્કર પુરાવાઓ સાથે પુરવાર કરે અને તે મહાત્માએ પણ ભારપૂર્વક અફ્સોસ વ્યક્તિ કરી પ્રાયસ્થિત પણ લીધું છે તે પુરવાર કરે અથવા મિચ્છામિ દુક્કડમ્ પાઠવે.

સુશ વાંચકો ! આપ સમજ શકો છો કે પૂ. બાપણ મહારાજ જેવી અત્યંત પૂજ્ય સ્થાન ધરાવતી વ્યક્તિ માટે આટલું નિરાધાર, નિભન્કક્ષાનું, નક્કર પુરાવા વિનાનું, હવામાં વાતો કરવા જેવું લખાણ માત્ર કુલાંગાર જ કરી શકે, દુશ્મન પણ તેમના જહેર લખાણો, જહેર

પ્રકાશનો અને તેમના સિંહસત્ય માટે પેટ ભરીને ગુણગાન ગાય, તે મહાપુરુષ માટે કુલાંગાર જ આટલુ અધમ કક્ષાનું લખાણ કરી શકે છે. કાલે લેખકશ્રી પોતાની ઉજવળ પરંપરાના પૂ. આત્મારામજી મહારાજ, પૂ.આ.ભ. દાનસૂરીશ્વરજી મહારાજ તથા અન્ય કોઈપણ મહાપુરુષ માટે તત્કાલિન મહાત્માઓના નામે ગમે તેવું લખાણ, ગમે તેટલી નિભન્કક્ષાનું લખાણ લખે તો નવાઈ પામતા નહિ ! માટે જ મારો આ પ્રયત્ન લેખકશ્રીની મનોદશા સુજ્ઞ વાંચકો સુધી પહોંચાડવાનો છે. જે આટલી નિભન્કક્ષાએ લખાણ લખી શકે તેની આદેયતા કેટલી ?

‘પુરુષ વિશ્વાસે વચન વિશ્વાસ.’ એકવાર આવા હડહડતા ગોળા ગબડાવનાર લેખકશ્રી માટે ‘પુરુષ વિશ્વાસે વચન વિશ્વાસ’ વાંચકોના હદ્યમાંથી નિકળી જય અને સુજ્ઞ વાંચકો લેખકશ્રી કેટલી નિભન્કક્ષાએ જઈ શકે છે તે જણી લે તેજ આ લખાણ માટેના પ્રયત્ન છે.

પૂ. પ્રેમસુરિ દાદા માટે અને પૂ. બાપજી મહારાજ માટે આટલી નિભન્કક્ષાનું લખાણ કોઈપણ પ્રેમસુરિ સંતાન અથવા પૂ. બાપજી મહારાજના સંતાનો બરદાસ્ત કરી શકે નહિ. લેખકશ્રીનો વિશ્વાસ કયાં રાખવો ?

આ તબક્કે અમે લેખકશ્રીને ભારપૂર્વક જણાવીએ છીએ કે થા નક્કર પુરાવાઓ સાથે પુરવાર કરો અથવા મિચછામિ દુક્કડમું પાઠવો.

‘મેરુ ડગે પણ જેના મન ન ડગે’ એવા એ મહાપુરુષ હતા.  
કોઈ એક વ્યક્તિ તો શું ગમે તેટલો મોટો સમુહ હોય તો પણ કોઈની  
મજાલ નથી કે તેમના ઉપર દ્વારા કરવાની હિંમત પણ કરે !

પૂ. બાપળ મહારાજાએ જહેરમાં કરેલા ખુલાસામાં જે શબ્દો  
તેમના હૃદયમાંથી સરી પડ્યા છે તે શબ્દો તેમના સિંહસત્વનું  
પ્રતિબિંબ છે. સિંહસત્વના સ્વામી એવા પૂ. બાપળ મહારાજ કોઈ  
એક વ્યક્તિના દ્વારા આવી ખુલાસો કરે તે કોઈ દુશ્મન પણ  
માનશે નહિ. ‘વચન સિદ્ધ પુરુષ’ તરીકે જેની સમગ્ર વિશ્વમાં ઘ્યાતિ  
હતી તેની ઉપર લેખકશ્રીએ પાણી ફેરવી નાંખ્યું.

ઉદ્યાત ચોથ વિરાધનારા લેખકશ્રી પૂજય બાપળ  
મહારાજના નીચેના શબ્દોનું શુદ્ધ હૃદયથી અવગાહન કરે તેવી  
લેખકશ્રીને અતિનમ્ર ભાવે વિનંતી.

‘આ નિયમ કથ્ય-વૃદ્ધિ વગરની તિથિએ કેમ લાગુ પડે ? જુઓ  
પાંચમનો કથ્ય આપ્યો ત્યારે મનાયો અને ઉદ્યતિથિની વિરાધના ન  
કરી, પણ (પાંચમની) વૃદ્ધિ આવી ત્યારે ઉદ્યતિથિ ચોથને વિરાધી.  
આ તો એવું થયું કે પરણવાની બાધા અને નાતરું મોકણું ! તેઓ  
વેરવૃત્તિ વધે તેવું કરે છે માટે આપણે બોલતા નથી-બાકી હડહડતુ  
અસત્ય છે.’ (પાછળ પરીશિષ્ટ-૧માં પૂ. બાપળ મહારાજનો  
ખુલાસો આપ્યો છે.)

## સંમેલનની મોટામાં મોટી નાલેશી

વધુમાં લેખકશ્રી પૃષ્ઠ. ૩૨ ઉપર જણાવે છે કે,

‘લેખકને (એટલે મને) પોતાને હદ્ય દ્રાવક લાગી ગયેલો સ્વ.પૂ. રામસુરિ ડહેલાવાળાનો પત્ર છાપ્યો છે, તો એની સામે પૂ. મેરુપ્રભસુરિ મહારાજે લાઘેલા સમાધાનોના પત્રનો ઉલ્લેખ સુદ્ધાં કેમ નથી કર્યો? ખરેખર તો લેખકે (એટલે મારે) વિચારવું જોઈએ કે આ પત્ર લખ્યા પછી પૂજય શ્રી ધર્મા વર્ષો જીવ્યા શ્રી સંધમાં મહુદયંશે સધાર્યેલી એકતાના સમર્થક અને પ્રોત્સાહક કેમ રહ્યા? જો એકતા ન જ સધાઈ હોત તો તેઓ છેક સુધી અધ્યક્ષપદે કઢી રીતે ચાલુ રહ્યા? નવા પક્ષવાળા પણ તેમને અનેક પ્રસંગે ‘અધ્યક્ષ’ સમજીને ચાલતા રહ્યા તે કઢી રીતે? તથા તેઓશ્રીના પત્રને ધ્યાનથી વાંચતા જણાશે કે તેઓશ્રી પણ એકતાનેજ સૌથી વધારે મહત્વની માનતા હતા. ને તેથી જીવનના અંત સુધી એ માટેની જ તેઓશ્રીની દુરધા ને પ્રયત્ન રહ્યા હતા? અસ્તુ.’

સૌથી પહેલા તો લેખકશ્રીએ વિચારવું જોઈએ કે સંમેલનની પુણીહૂતિના પાંચ પાંચ વર્ષો સુધી રાહ જેયા બાદ ભા.સુ.૧૦ વિ.સં. ૨૦૪૮માં અધ્યક્ષશ્રીએ પોતાની વેદના ઢાલવતો પત્ર લખ્યો છે. અધ્યક્ષશ્રી એ પાંચ પાંચ વર્ષો સુધી વેદના સહન કર્યા પછી કોઇ જ ઉપાય રહ્યો નહિ ત્યારે નિખાલસ પણો સત્ય સમગ્ર તપાગચ્છના ધ્યાનમાં લાવ્યું છે. તે અધ્યક્ષશ્રીની નિખાલસતા લેખકશ્રીએ નજર અંડાજ કરવા જેવી નથી.

ઉપરાંત લેખકશ્રીના અનુસાર પૂ.આ. મેરુપ્રભસૂરિ મ.ને પણ સમાધાનો આપવા પડ્યા. તેજ બતાવે છે ક સંમેલનના નિર્ણયોમાં ગંભિર ભુલો થઈ છે. અને તે પત્ર અમારી પાસે નથી તો અમે કેવી રીતે રજુ કરીએ ? અમે લેખકશ્રીને જ વિનંતી કરીએ છીએ કે તેઓશ્રી તે સમાધાનોનો પત્ર અને તેનો પણ પ્રત્યુત્તર રજુ કરે. પાંચ પાંચ વર્ષે સમાધાનો રજુ કરવા પડે તે સંમેલનની સૌથી મોટામાં મોટી નાલેશી છે. છતાં લેખકશ્રી જણાવે છે કે ‘તેઓશ્રીના પત્રને ધ્યાનથી વાંચશો તો જણાશો કે તેઓશ્રી પણ એકતાને જ સૌથી મહત્વની માનતા હતા’ - અમે પણ લેખકશ્રીને પ્રશ્ન કરીએ છીએ કે જે અધ્યક્ષશ્રી એકતાનેજ સૌથી મહત્વની માનતા હતા તો વિ.સં. ૨૦૪૨ના પછુંકમાં સહી કરવાનો કેમ ધરાર ઠંકાર કર્યો ? શા માટે સકળ સંઘથી સંવત્સરી અલગ કરી ? પોતાના દાદાગુરુદેવ સ્વ.આ.ભ. પ્રેમસૂરીશ્વરજી મહારાજાએ સકળ સંઘથી અલગ આરાધના કરી તેમણે પાછળથી પ્રાયસ્થિત કર્યું તેમ કહેવાની ધૂષ્ટતા કરનાર લેખકશ્રી સંમેલનના અધ્યક્ષે વિ.સં. ૨૦૪૨માં સકળ સંઘથી અલગ આરાધના કરી તેના માટે એક હરફ પણ કેમ ઉચ્ચારતા નથી ? લેખકશ્રીનો આ કહેવાતી એકતાનો અંધાપો કંઈ જ જેવા તૈયાર થતો નથી એ અત્યંત આધાતજનક છે. હવે એ સંમેલનના મૃતકને ખલે લઈને ફરનારા લેખકશ્રીને નીચેના પ્રશ્નોના પ્રત્યુત્તર પાઠવવા વિનંતી.

- પ્ર. ૧ સંમેલનના નવા અધ્યક્ષની જહેરાત હજુ સુધી કેમ કરી શકતા નથી ?
- પ્ર. ૨ સંમેલનના વિવાદાસ્પદ ૨૨ ઠરાવોની ૧૭-૧૭ વર્ષ સુધી કેમ કોઈ સમીક્ષા સમગ્ર તપાગચ્છની સામે કરવામાં આવી નથી ?
- પ્ર. ૩ સંમેલનમાંથી સત્તાવાર કે બિનસત્તાવાર લગભગ બધાજ સમુદ્દરાય કેમ ખસી ગયા ?
- પ્ર. ૪ પૂ. આ. નરેન્દ્રસાગરસૂરિના જણાવ્યાનુસાર સંમેલને શાસ્ત્રપરંપરાના આધારો લીધા નહોતા તેને આપનું સમર્થન છે ?
- પ્ર. ૫ પૂ. આ. નરેન્દ્રસાગરસૂરિના જણાવ્યાનુસાર જે સંમેલને લીધેલા નિર્ણયોમાં સુધારા ન જ થાય તો ભાવિમાં જૈન સંધોને, જૈન શાસનને ભયંકર અનર્થ થવાનું અને ક્રમે તેઓનું અધઃપતન પણ થવાનું થાય એમ મને જણાય છે તેમાં આપ સહમત છો ?
- પ્ર. ૬ અત્યારે પ્રવર સમિતિ છે કે કેમ ? છતાં છે તો કોણ કોણ છે ? તે પ્રવરસમિતિનું તપાગચ્છના પ્રાણ પ્રશ્નો માટેનું ધોગદાન છેલ્લા ૧૭ વર્ષોમાં કેટલું ?
- પ્ર. ૭ આપશ્રીના આ બન્ને પુસ્તક (ભાગ-૧-ભાગ-૨) ને પ્રવર સમિતિની સત્તાવાર મહોરછાપ નથી તેનું શું ?

- પ્ર. ૮ 'જે તે તે સમુદ્દરની માંગણી ન સંતોષાય તો તેઓ સંમેલનથી છૂટા થવાની તૈયારી વાળા હતા તો ગીતાર્થતા ક્યાં રહી ?
- પ્ર. ૯ જ્યારે અધ્યક્ષશ્રી ખુદ સાફ સાફ સ્વીકારે છે કે સંમેલન ખોખરું થઈ ગયું છે તો જીવનના અંત સુધી તેઓએ શા પ્રયત્ન કર્યા ?
- પ્ર. ૧૦ પૂ.આ.ભ. મેરુપ્રભસુરિએ કયા કયા સમાધાનો દર્શાવેલા ? તે સમાધાનો માટે પ્રવરસમિતિએ શું નિર્ણય લીધો ?
- પ્ર. ૧૧ અધ્યક્ષશ્રીના જણાવ્યા અનુસાર સંઘમાં હાલ ૪ થી ૫ વિભાગ થઈ ચુક્યા છે તો ગીતાર્થતા ક્યાં રહી ?
- પ્ર. ૧૨ સંમેલનમાંથી છૂટા થયા બાદ સ્વ. ગરછા દિપતિ દર્શનસાગરસૂરિએ સંમેલનના તિથિ અંગેના ઠરાવને અયોગ્ય જલેર કરી પાંચમના ક્ષયે ત્રીજનો ક્ષય કરવાની જલેરાત કરી તમારા કહેવાતા સંમેલનથી (સંઘથી) અલગ આરાધના કરવાનું જલેર કર્યું તો તમારા મતે સંઘથી જુદા પડનાર માટે તમે શો અભિપ્રાય આપશો ?
- પ્ર. ૧૩ પ્રવર સમિતિમાં બધા જ ને પ્ર.સ.માં સ્થાન આપવું પડ્યું.....અને તે તે માંગણી કરનાર સમુદ્દરને આ સમિતિમાં પ્રવેશ ન મળે તો સંમેલનથી છૂટા થવાની તૈયારીવાળા હતા તેમાં તમારો (લેખકશ્રીનો) સમુદ્દર પણ આવી ગયો, તો પછી ગીતાર્થતા ક્યાં ગઈ ? તમારા સમુદ્દરયે

પણ માંગળી કરી અને ન સંતોષાય તો છૂટા થવાની તૈયારીવાળા તમે પણ હતા તેમ અધ્યક્ષનો પત્ર સ્પષ્ટ જણાવે છે. તો પછી એકતાની બે ધારી વાતો કરી ભદ્રિક આત્માઓને શા માટે ગુમરાહ કરો છો ? ને છતાં તેને 'શ્રી સંધ' કહો છો ?

હવે લેખકશ્રી જણાવે છે કે તે (શાસ્ત્રવજ્ઞાદાર) પક્ષવાળા પણ તેમને 'અધ્યક્ષ' સમજુને ચાલતા રહ્યા, તે ધરાર સત્યથી વેગળું છે. 'અધ્યક્ષ' સમજુને નહિ પણ પ્રસંગવિશેષ 'અધ્યક્ષ' સંબોધીને ચાલતા રહ્યા. દા.ત. મહાત્મા ગાંધીજી શબ્દ વ્યવહારમાં વપરાય છે. તો ત્યાં ગાંધીજીને મહાત્મા સમજુને નહિ પણ અવસરે વ્યવહારથી સંબોધીને લખવું પડે છે તે રીતે અહીં પણ સમજવું. દાદા ભગવાનના કોઈ પ્રસંગનો ઉલ્લેખ તેમના નામથી વ્યવહારથી કરવો પડે તો તેમાં કંઈ દાદા ભગવાન, ભગવાન નથી બની જતા ! અસ્તુ.

લેખકશ્રીની બન્ને માંગળીઓની પ્રતીતિ અમે કરાવી દઈએ છીએ

લેખકશ્રી પૃ. ૩૩ ઉપર જણાવે છે કે,

'મારી એક 'તિથિ અંગે સત્ય અને સમાધાન' નામની પુસ્તિકા અંગે પ્રકાશિત મહત્વની વાતો સંક્ષેપમાં જણાવી છે. હજુ કદાચ અન્ય સાહિત્ય પણ પ્રકાશિત થાય...કે આ પુસ્તિકા અંગે કંઈક પ્રકાશિત થાય પણ જે મને એવી પ્રતીતિ થશે કે,... શાસ્ત્રબોધ ધરાવનાર વ્યક્તિએ

પ્રમાણિક પણે રજુઆત કરી છે અને એકજ દિવસે આરાધના કરવી કે ઉદ્યાત્ તિથિ પકડવી આવો પ્રશ્ન નિર્માણ થયો હોય ને એવે વખતે ઉદ્યાત્ તિથિ પકડવી. આવુ માર્ગદર્શન આપનાર પૂર્વચાર્યના સંદર્ભ ટાંક્યો છે, તોજ હવે આ પ્રકાશન અંગે યોગ્ય વિચાર કરવો, અન્યથા નહિ આવી મારી ગણતરી છે એની સર્વેને નોંધ લેવા વિનંતી.’

જે લેખકશ્રીને પ્રતીતિ કરવી જ હશે તો તેમની કલમ પ્રમાણે શાસ્ત્રબોધ ધરાવનાર વ્યક્તિએ પ્રમાણિકપણે રજુઆત કરી છે તે સંતોષવા અમે શાસ્ત્રબોધ ધરાવનાર, સકલાગમરહસ્યવેહીનું બિઝું જેઓશ્રી ધરાવે છે તે લેખકશ્રીના જ પ્રદાદાગુરુદેવ સ્વ.આ.ભ. દાનસૂરીશ્વરજી મહારાજના જ શબ્દો અને તે પણ લેખકશ્રીના જ પ્રકાશનમાં તેઓએ રજુ કર્યા છે તે અતે અમે રજુ કરીએ છીએ જેમાં તેમની કલમ-૨ પણ સંતોષાધ જય છે.

‘વિવિધ પ્રશ્નોત્તર’ પૃષ્ઠ ૩૪૩ ઉપર સ્વ.આ.ભ. દાનસૂરીશ્વરજી મહારાજના શબ્દોમાં, ‘આરાધ્ય તિથિઓને માટે શ્રી શાસ્ત્રકાર મહારાજનો જેવો નિયમ કથ્યમાં પૂર્વ તિથિ ગ્રહણ કરવા માટેનો છે; તેવો જ નિયમ ઉદ્યમાં જે તિથિ હોય તે કથ્યમ રાખવાનો છે.’

“આ તિથિઓને ફેરવવી શાસ્ત્રકાર મહારાજને બિલકુલ દીઘ નથી. સૂર્યોદયમાં રહેલી એ તિથિઓને જેઓ ફેરવે છે તેમની શાસ્ત્રકાર મહારાજ કડક શબ્દોમાં ખખર પણ લઈ નાંખે છે. તે

શ્રાદ્ધવિવિના ત્રીજ ઉત્તાસમાંનો નીચેનો ઉત્તેખ વાંચતા સ્પષ્ટ  
દેખાઈ આવે છે.

ચાઉમ્મસિય વરિસે, પકિખય પંચમીસુ નાયવા । .  
તાઓ તિહિઓ જાસિ, ઉદેઝ સૂરો ન અન્જાઓ ॥૧॥  
પૂયાપચ્ચકર્ખાણં, પડિકક્રમણં તહ્ય નિયમગૃહણં ચ ।  
જોએ ઉદેહ સૂરો, તીહ તિહિએ ઉ કાયવં ॥૨॥  
ઉદ્યમ્મિ જા તિહી સા, પમાણમિયરીં કીરમાણીએ ।  
આણાભંગડણવત્થા મિચ્છત વિરાહણં પાવે ॥૩॥

ભાવાર્થ : ચોમાસી, સંવત્સરી, પક્ખી પાંચમ તથા આઠમાંથી  
તે તિથિઓ જાણવી કે જેમાં સૂર્ય ઉદ્ય પામે પણ અન્ય નહિ.  
પૂજ, પચ્ચિખાણ, પ્રતિકમણ તથા નિયમગૃહણ પણ એ જે  
પ્રમાણે જેમાં સૂર્ય ઉદ્ય પામે તે તિથિમાં કરવું. ઉદ્યમાં જે તિથિ  
હોય તે પ્રમાણ કરવી પણ ઉદ્ય તિથિ મૂકીને બીજી તિથિ કરવાથી  
ફેરફાર કરનાર આજ્ઞાભંગ, અનવસ્થા, મિથ્યાત્વ અને વિરાધનાદિ  
દોષોને પામે.

લેખકશ્રીને પ્રતીતિ કરવી જ હશે તો, આ સુવર્ણ અવસર છે.

૧. તેઓશ્રીના જ પ્રદાદાગુરુ સ્વ. પૂ.આ.ભ. દાનસૂરીશ્વરજી  
મહારાજ શાસ્ત્રબોધ ધરાવનાર છે તેનો ખૂદ લેખકશ્રી પણ  
ઇન્કાર કરી શકે તેમ નથી જ.

૨. ‘સકલાગમ રહસ્ય વેદી’નું બિઝુટેમને અર્પણ કરવામાં આવ્યું છે.
૩. તેઓશ્રીનું જ લખાણ અમે અતે રજુ કર્યું છે.
૪. તેનું પ્રકાશન પણ લેખકશ્રીના જ મહાત્માઓએ કર્યું છે.
૫. તે સંપૂર્ણ લખાણ જિજ્ઞાસુઓ વિવિધ પ્રશ્નોત્તરના પૃ.નં. ૩૩૬ થી ૩૪૬ સુધી સંપૂર્ણ વાંચી શકે છે, જેથી લેખકશ્રીને કહેવાનું ન રહે કે અમે કંઈ છૂપાવ્યું છે.

હવે તો લેખકશ્રીએ જ જહેર કરવાનું રહે છે કે તેઓશ્રીને તેમના જ પ્રદાદાગુરુદેવનું પૃ. ૩૩૬થી ૩૪૬ સુધીનું લખાણ સ્વીકાર્ય છે કે નહિ ?

જે લેખકશ્રી પોતાના જ પ્રદાદાગુરુ સ્વ. આ.ભ. દાનસૂરીશ્વરજી મહારાજનું લખાણ પણ નહિ સ્વીકારે તો તેમના કુમતિ મદનું ગાલન પછી તો કોઈ જ કરી શકે તેમ હાલ તો જણાતું નથી. તે સિવાય પણ ઉદ્યાત્ તિથિ ના નીચેના શાસ્ત્રપાઠો છે.

૧. પૂ.આ.ભ. પ્રેમસૂરીશ્વરજી મહારાજ (પદ્ધક વિ.સં. ૨૦૨૦)
- “તિથિદિન અને પર્વારાધન બાબતમાં શ્રી સંઘમાન્ય પંચાંગમાં બતાવેલી સર્વ પર્વાપર્વ તિથિઓની ક્ષય-વૃદ્ધિ યથાવત માન્ય રાખીને આપણો જે રીતે ‘ઉદ્યંભિ૦’ તથા ‘ક્ષયેપૂર્વા૦’ ના

નિયમ અનુસાર તિથિદિન અને આરાધનાદિન નક્કી કરીએ છીએ  
તે શાસ્ત્રાનુસારી છે. તેમજ શાસ્ત્રમાન્ય પ્રાચીન પરંપરાનુસારી  
છે. લવાદી ચર્ચામાં તેવા પ્રકારનો નિર્ણય આવી જ ગયેલો છે.

૨. ઉદ્યંમિ જા તિહી સા પ્રમાણમિઅરીઝ- કિરમાણીએ ।  
આપાભંગ-ણવત્થા-મિચ્છત-વિરાહ્પણ પાવે ॥

અર્થ : સૂર્યોદય સમયે જે તિથિ હોય તે પ્રમાણ જાણવી. એ  
સિવાયની બીજી તિથિને પ્રમાણ કરવાથી બ્જિનાજ્ઞાભંગ,  
અનવસ્થા, મિથ્યાત્ત્વ અને વિરાધના આ ચાર દોષો લાગે છે.  
(‘શ્રાદ્ધવિધિ કૌમુદી’ - પૂ. આચાર્યદ્વિતી શ્રીમહૃ રત્નશેખરસૂરીશ્વરજી  
મહારાજ)

૩. યસ્યામુદ્યતે સૂર્યઃ, સા પ્રમાણં તિથિભવિત् ।  
પ્રત્યાર્થ્યાનાદિ કર્તવ્યં, તસ્યાં વિવેકિભિર્જનૈः ॥
- અર્થ : ‘જેમાં સૂર્ય ઉગે છે તે તિથિ પ્રમાણ થાય છે. એમાં  
વિવેકી જનોએ પચ્ચક્ખાણ વગેરે કરવાં જોઈએ.’  
(ઉપદેશ કલ્પવલ્લી)

૪. સોળમા સૈકામાં થયેલા પ્રભ્યાત શાસ્ત્રકાર પૂ. ઉ. શ્રી  
ધર્મસાગરજી મહારાજે ‘તત્ત્વતરંગિણી’ નામના ગ્રંથમાં ઉદ્ય તિથિ  
જ પ્રમાણ કહી છે. જુઓ - પૃષ્ઠ-૩

‘संवच्छर-चउमासे, पकख्वे अद्वाहिअ तिहीसु ।

ताउ पमाणं भणिया, जाओ सूरो उदयमेङ ॥’

अर्थ : ‘संवत्सरी, चातुर्मासी, पक्खी, अदृष्टादिनी तिथिओमां ते ज्येष्ठ तिथिओ प्रभाष कही छे के ज्येष्ठ तिथिओमां सूर्य उदय पामे छे.’

५. तपावली-तपोरत्न भहोदधिभां पाण उद्यतिथिनो भज्जभुत पाठ आपेलो ज्ञेवा भणे छे. एमां ज्ञानाव्युं छे के -

तिथिजे तपसि श्रेष्ठा, सूर्योदयगता तिथिः ।

तिथिपाते च पूर्वस्मिन्नहि वृद्धौ परन्त्र च ॥

“तिथि साथे संबंध धरावता तपोमां सूर्योदयनी साथे रहेली (आवेली) तिथि श्रेष्ठ गाणाय छे. तिथिनो ज्यारे क्षय होय त्यारे ए तिथिनो तप एना पूर्वना दिवसे करवो अने तिथिनी ज्यारे वृद्धि होय त्यारे ए तिथिनो तप बीज दिवसे करवो.”

६. सूर्योदयने प्राप्त थयेली तिथि ज्येष्ठ दान, अध्ययनादि कार्यो माटे भानवी ज्ञेईए. ए भाबतने ज्ञानावतो एक श्लोक आ मुज्जभ भणे छे-

“यां तिथिं समनुप्राप्य, उदयं याति भानुमान् ।

सा तिथिः सकला झेया, दानाध्ययनकर्मसु ॥

~~~~~

અર્થ : જે તિથિને પામીને સૂર્ય ઉદ્ઘયને પામે છે, તે તિથિ દાન, અધ્યયન વગેરે કાર્યોમાં સંપૂર્ણ જાણવી જોઈએ.'

આટલા શાસ્ત્રપાઠો ઉદ્ઘતિથિના આપ્યા છે. એકપણ શાસ્ત્રપાઠ એવો નથી કે શુદ્ધઉદ્ઘતિથિ મળતી હોવા છતાં તેને છોડવી તેમ જણાવતો હોય.

તો પછી એ શાસ્ત્રપાઠપુરવાર કરવાની જવાબદારી લેખકશ્રીની છે.

ઉપર સબળ શાસ્ત્રપુરાવા આપ્યા છતાં લેખકશ્રીને પ્રતીતિ ન થતી હોય તો, અથવા ન જ કરવી હોય તો 'એક જ દિવસે આરાધના કરવી કે શુદ્ધ ઉદ્ઘયાત્ત તિથિ પકડવી આવો ગ્રહન નિર્માણ થયો હોય તે વખતે ઉદ્ઘયાત્ત તિથિને છોડવી તેવું લેખકશ્રી માનતા હોય તો તે શાસ્ત્રપાઠ, પૂર્વાચાર્યના પ્રામાણિક સંદર્ભો-શાસ્ત્રપાઠ વિ. આપવાની જવાબદારી લેખકશ્રીની છે.

બાકી તપાગચ્છના શાસ્ત્રો એકી અવાજે સ્પષ્ટ જણાવે છે કે શુદ્ધ ઉદ્ઘતિથિ મળે તો તે ઉદ્ઘતિથિને છોડી અન્ય તિથિ આરાધવાથી આજાભંગ, અનવસ્થા, મિથ્યાત્ત્વ અને વિરાધના એ ચાર મહાદોષ લાગે લાગે અને લાગેજ.

~~~~~

લેખકશ્રી અંતિમ પૃષ્ઠ ઉપર જણાવે છે કે,

‘તો પછી શ્રી તપાગચ્છ સંધ તેરસની કથવૃદ્ધિ કરતો હોય એટલા માત્રથી એને આજ્ઞાભંગ વગેરે દોષો શ્રી રીતે લાગી જય ? અમે કરીએ તો અમને દોષ ન લાગે અને શ્રી સંધ તેરસની કથ વૃદ્ધિ કરે તો શ્રી સંધને દોષ લાગે. આ તે કેવો ન્યાય ?’

આનું સમાધાન આપણે પૂ. બાપજી મહારાજના શબ્દોમાં જ જોઈએ ‘શાસ્ત્રની આજ્ઞા મુજબ તો બે પૂનમની બે તેરસ અને પૂનમના કથે તેરસનો કથ થાય-કરે નહિ.’ તથા આનું સમાધાન આપણે લેખકશ્રીના જ પ્રકારાન ‘વિવિધ પ્રશ્નોત્તર’ના આધારે તેમના જ પ્રદાદાગુરુ પૂ.આ. દાનસૂરીશ્વરજી મહારાજના શબ્દોમાં જોઈએ. (પૃષ્ઠ ૩૪૨)

xxx ‘ટીપ્પણામાં જે પૂનમનો કથ હોય તો તેનો કથ પૂર્વતિથિ ચતુર્દશીમાં હોવાથી શાસ્ત્રાધારે ચઉદ્ધશને દિવસે બંને તિથિનું આરાધન કરવું પણ તેરસને દિવસે ચઉદ્ધશ અને ચઉદ્ધશને દિવસે પૂનમ એમ ન કરવું.’ xxx

xxx ‘શાસ્ત્રની નીતિ પ્રમાણે તો પૂનમનો કથ હોય ત્યારે પણ ચતુર્દશી જ ગ્રહણ કરાય છે. કેમકે ઉદ્યતિથિ ચતુર્દશી જ છે એટલે શાસ્ત્રનો આધાર ‘તેરસે, ચતુર્દશી અને ચતુર્દશીએ પૂનમ’ એમ કરવાનું કહેતો નથી.’ xxx

~~~~~

~~~~~

xxx 'આગમના પાઠોને મનધર્તંત લઈ જવાની ધૂને ચહેલો  
જે આમાં પણ પોતાનું ડોકું ધૂણાવે તો તેના જેવી હાસ્યાસ્યદ બીજુ  
એક પણ વસ્તુ ગળાશે નહિ.' xxx

લેખકશ્રી 'શ્રી સંધ' શબ્દ પ્રયોગ પોતાની સ્વમતિ કલ્પિત  
માન્યતા માટે કરે છે તે જરાપણ યોગ્ય નથી. વાસ્તવમાં

૨૫મા તીર્થકર સ્વરૂપ શ્રી સંધ કોને કહેવાય ?

(પૂર્વાચાર્યવિરચિત શ્રી સંધસ્વરૂપ કુલક)

કેઇ ઉમ્મગઠિયં, ઉમ્મગપરલુબયં બહુલોયં ।

દલ્લું ભણાંતિ સંધં, સંધ સરલુબમળાયંતા ॥૧ ॥

સુહસીલાઓ સચ્છંદચારિણો વેરિણો સિવપહસ્સ ।

આણાભદ્રાઓ બહુ જણાઓ મા ભણહ સંઘુતિ ॥૨ ॥

અર્થ : સંધના સ્વરૂપથી અજ્ઞાત લોકો ઉન્માર્ગમાં સ્થિર  
રહેલા તથા ઉન્માર્ગની પ્રરૂપણા કરતા ધણા મનુષ્યોને જેઇને સંધ  
કહે છે (૧)

પરંતુ તે સંધ કહેવાતો નથી. કારણકે તે સુખશીતીઆ,  
સ્વરૂપંદાચારી, મોક્ષમાર્ગના વૈરી અને શ્રી લિનેશ્વર દેવની  
આજ્ઞાથી બાહ્ય-એવા સમૂહને સંધ ન કહેવાય (૨)

~~~~~  
अम्मापियसारित्थो सिवघरथम्भो य होई सुसंघो ।

आणाबजङ्गो संघो, सप्पुव्वभयंकरो इण्हिं ॥३॥

अर्थ : सुसंघ ભાતાપિતાની સરખો છે. મોક્ષપી ધરના સ્થંભભૂત છે અને શ્રી જિનેશ્વરની આજાથી બાહ્ય સંઘ આસંસારમાં ભયંકર સર્પ જેવો છે. (3)

૨૪ તીર્થકરની આજા માને તેને ૨૫મો તીર્થકર સ્વરૂપ સંઘ કહેવાય.

અંતે સૌ કોઈ સત્ય સમજ પરમાત્માની આજાનુસાર આરાધના કરી વહેલામાં વહેલા મુક્તિ સુખને પામે એજ એકનીએક પરમાત્માને પ્રાર્થના.

જિનાજા વિરુદ્ધ કંઈપણ લખાયું હોય તો ત્રિવિધે ત્રિવિધે મિચ્છામિ દુક્કડમ्

सिद्धांत महोदधिनी છાપ લેખકશ્રીએ ખાખોચિયા જેટલી કરી નાંખી

લેખકશ્રી પ્રસ્તુત પુસ્તક ભાગ-રના પૃષ્ઠ. ૨૦ ઉપર

‘પૂ.આ.ભ. પ્રેમ સૂ.મ.સાહેબે, ‘તુ ૨૦૨૦નો પછુક રદ કરી નાંખજે’ એવું કહેલું હતું... વગેરે જે પ્રચાર અમુક વર્ગ તરફથી વારે વારે થાય છે તેમાં પાછળ બચાવ સિવાય બીજુ કશું જણાતું નથી.’

આ અંગે જણાવવાનું કે પૂ.આ.શ્રી રામચન્દ્ર સૂ.મ.સા. એ તો પછુકમાં જણાવેલી સાચી સંવત્સરી જણવી જ રાખી છે જ્યારે લેખકશ્રીના પક્ષે તો આખો પછુક જ ભાંગને ભુક્કો કરી નાખ્યો છે એટલે હવે લેખકશ્રીએ જ ખુલાસો કરવાનો રહે છે.

હવે લેખકશ્રીના પ્રસ્તુત પુસ્તક ભાગ-રના પૃષ્ઠ-૨૧ ઉપર સ્વ.પૂ.આ.ભ. પ્રેમ સૂ.મ.નો જવાલનો વિ.સં. ૨૦૧૮નો કહેવાતો ઉપજનવી કાઢેલો અધાપિપર્યત અપ્રગટ ફરમાન પત્રાંશની કપોળ કલ્પિત જે વાતો રજુ કરી છે, તે સુજા વાંચકો માનશે કે પછી તેજ જવાલથી લખાયેલ, ‘વિ.સં. ૨૦૧૮ના કા.સુ. ૧૫ના ક્ષયે શું કરવું’ તેનો લેખકશ્રીના જ દિવ્યદર્શન પૃષ્ઠ-૪૦, તા. ૨૭-૧૦-૬૨ ના અંકમાં સત્તાવાર પ્રગટ થયેલ પત્ર માનશે ? ૪૨-૪૨ વર્ષો સુધી અને હજુ પણ તે કહેવાતો પત્ર સત્તાવાર રીતે પ્રગટ કરતાં લેખકશ્રી કેમ પારોઠના પગલાં ભરે છે ? શું વચન સિદ્ધપુરુષો એકજ વર્ષમાં વારે વારે પોતાના વિચારો ફેરવતા હશે ? લેખકશ્રીએ સિદ્ધાંતમહોદધિ સ્વ.પૂ.આ.ભ. પ્રેમસુરિશ્વરજીની છાપ ખાખોચિયા જેટલી કરી નાંખી. પોતાના ગુરુભગવંતે પ્રાયસ્થિત કર્યું તેમ કહેનાર લેખકશ્રીએ ખૂદ પોતે ગુરુભગવંતના કાળધર્મ બાદ પણ તેમના કહેવાતા સંધથી અલગ આરાધના (વિ.સં. ૨૦૨૪થી

૨૦૪૨ સુધી) કરી તેનું હજુ સુધી પ્રાયશ્ચિત નથી કર્યું ! મહા આશ્રયમ્ ! લેખકશ્રીના ભક્તો પણ એટલા ભોળા નથી કે લેખકશ્રીની તદ્દન વાહિયાત વાત પણ માની લે.

તિથિ બાબતમાં સ્વ.આ.પ્રેમ સ્નૂ.મ.સા. એ પ્રાયશ્ચિત કર્યું તેમ કહેવાની ઘૃષ્ટતા કરનાર લેખકશ્રી તેજ ગુરુભગવંતનું ગ્રહણ અંગેનું શાસ્ત્રીય માર્ગદર્શન જે પ્રખર પંડિત કુંવરજીભાઈ આણંદજીને બતાવેલું તેને હવે પછી વફાદાર રહેશે ? કે પછી તેમાં પણ સ્વ.આ.પ્રેમ સ્નૂ.મ.સા.એ પ્રાયશ્ચિત કર્યું તેમ કહેશે ?

સ્વ.આ.ભ.પ્રેમસુરિ મ. ૩૧-૭-૪૪ના પત્રના પ્રત્યુત્તરમાં જણાવે છે કે, “ગ્રહણ વખતે દેરાસરો ઉધાડા રાખવાની અને વ્યાખ્યાન વાંચવાની જે પ્રવૃત્તિ કરવામાં આવી તેમાં આપ સમ્મંત છો” આવો પ્રશ્ન પુછવાનું થયું તેજ આશ્રયજીનક છે. કારણકે મારા સાધુઓ કોઈપણ શાસ્ત્રથી અભાધિત પ્રવૃત્તિ કે પ્રક્રિયા કરે તેમાં મારી સંમતિ જ હોય અને આ પ્રવૃત્તિ શાસ્ત્ર બાધિત નથી. આરાધ્યપાદ સંઘસ્થવિર, શાંતતપોમૂર્તિ આચાર્યદિવ શ્રીમહ વિજય સિદ્ધિસૂરીશ્વરજી મહારાજ શ્રી જૈન વિદ્યારાણામાં વિરાજમાન છે ત્યાં મંદિર પણ ખુલ્લું હતું અને વ્યાખ્યાન પણ ચાલુ હતું. ગ્રહણને અંગે સૂત્રનો અસ્વાધ્યાય છે પણ દર્શન-પૂજનનો તથા ઉપદેશ આહિનો પણ નિષેધ તો અમે જાણ્યો નથી અને આચર્યો પણ નથી.’

લેખકશ્રીએ ગ્રહણ અંગેની પૂ. ગુરુભગવંત પ્રેમ સ્નૂ.મ.ની માન્યતાની વફાદારી પણ છોડી. સામે ચાલીને સામાપક્ષે ગયા છે માટે તેઓ જે કરે તેમાં મતુ માર્યા વિના લેખકશ્રીને છૂટકો નથી.

~~~~~  
તેજ પત્રમાં તિથિ અંગેનું સવ. પૂ. આ. ભ.

### પ્રેમસૂરીશ્વરજી મહારાજનું લખાણ

તેઓ શ્રીમહ્ય જણાવે છે કે - “મારા પ્રત્યે તમે ગુરુભાવ ધરાવો છો તો હવે હું તમને જણાવું છું કે તમોએ તિથિચર્ચાનો નિર્ણય કે જે સુશ્રાવક કસ્તુરભાઈ લાલભાઈ દ્વારા પ્રસિદ્ધ થયો છે, તે વાંચશો અને વિચારશો. આરાધક આત્માઓના સદ્ગુરૂએ સાચો નિર્ણય થવા પાખ્યો છે. આવો સ્પષ્ટ નિર્ણય મેળવી આપવાનો સુયશ સુશ્રાવક કસ્તુરભાઈ લાલભાઈને ઘટે છે. પ્રોફેસર વૈધ જેવા મધ્યસ્થને લાવીને શ્રી જૈનશાસનની આજા મુજબનો નિર્ણય લાવી આપવામાં સુશ્રાવક કસ્તુરભાઈએ શ્રી જૈનશાસનની અનુપમ સેવા બજાવી છે. આવી સેવા બજાવવાનું સામર્થ્ય તેમનામાં હતું અને તે સામર્થ્યનો તેઓએ સારામાં સારો સદૃપ્યોગ કરી મેળવી આપેલો સાચો નિર્ણય વાંચી, વિચારી અમલમાં મૂકવા જેવો છે. એ નિર્ણય મુજબ ચાલવામાં દરેકે દરેક તિથિનું આરાધન આજા મુજબ થાય છે અને મહૃત્ત્વના પર્વની વિરાધનાથી પણ સારી રીતિએ બચી શકાય છે.”

પૂ. આ. ભ. લભિસૂરીશ્વરજી મહારાજનો પત્ર

લેખકશ્રીનું હડહડતુ જુઠાણું

લેખકશ્રી પૂ. આ. ભ. લભિસૂરિ મ. સાહેબના વિ. સં.  
૨૦૦૧ના દ્વિત્ય ચૈત્ર સુદ ૧૩, પાલિતાણા શાંતિભુવનના પત્રનો

ઉલ્લેખ કરે છે. તે કહેવાતો ઉપજલી કાઢેલો પત્ર અધાપિપર્યત અગ્રગટ છે. માટે જ વિશ્વસનીય નથી એટલું જ નહિ, લેખકશ્રીનું હહહતું જુદ્ધાણું છે. ૬૦-૬૦ વર્ષો સુધી જે પત્ર ગ્રગટ ન કરી શક્યા તેની વિશ્વાસનીયતા કેટલી ? તેની સામે તેજ આ. ભ. લભ્યસ્તૂરીશ્વરજી મહારાજ એ વિ. સં. ૨૦૧૫ શ્રાવણ વદ ઉ શુક્રવાર તા. ૨૧-૮-૫૮ના જન્મુભિ કાર્યાલયના વ્યવસ્થાપક સુશ્રાવક અમૃતલાલ લક્ષ્મીચંદ શાહને લખેલો પત્ર

દે. શ્રી આત્મ-કુમલ-લભ્યસ્તૂરીશ્વરજી જૈન જ્ઞાનમંદિર,  
૬, એસ. લેન, મુ. દાદર-૨૮ (બી. બી)  
વિ. સં. ૨૦૧૫, શ્રાવણ વદ-૩, શુક્રવાર,  
તા. ૨૧-૮-૫૮

‘પપમા પાને આચાર્યશ્રી વિજય પ્રતાપસૂરિજીનો પત્ર તમોએ છાય્યો છે, એમાં અમારા નામનો ઉલ્લેખ છે. તે બાબતમાં જે અંગત ખુલાસો કરવો જરૂરી છે. તે જણાવું છું.’

૧-વિ. સં. ૧૯૮૨ સુધી ભા. સુ. પાંચમના ક્ષયે ભા. સુ. ૪ના જ શ્રી સંવત્સરી પર્વ શ્રી સંઘ કરતો હતો, પણ આચાર્યશ્રી વિજય પ્રતાપસૂરિજી અને તેમના જેવા અભિપ્રાયવાળા બીજાઓને શ્રીસંઘની તે ચાલુ પ્રણાલિકાને વિ. સં. ૧૯૮૨માં ભા. સુ. પાંચમ બે આવતાં ચાલુ રાખી નહિ અને ભા. સુ. ચોથે શ્રી સંવત્સરિ નહિ

કરતાં ભા.સુ. પહેલી પાંચમે સંવત્સરી કરી. આથી જ જ્ઞાનવૃદ્ધ, વયોવૃદ્ધ, ચારિત્રવૃદ્ધ, સંઘસ્થવિર પૂ. આચાર્યદિવ શ્રીમહ વિજય સિદ્ધિસૂરીશ્વરજી મહારાજ વગેરે અમોએ તિથિદિન અને પર્વદિન બાબતમાં શાસ્ત્રથી વિરુદ્ધ જે કેટલીક ગરબડ ચાલતી હતી, તેને તજી દઈને શાસ્ત્રશુદ્ધ માર્ગને આચરવા માંડ્યો છે.

૨ - અમોએ વિ.સં. ૧૯૮૮માં આરાધનામાં બે પાંચમ માની ન હતી, કેમ કે બીજી પાંચમે જ પાંચમ પર્વ માન્યું હતું અને પહેલી પાંચમના દિવસે તિથિ નિયત કાર્ય માટે વજ્ય માન્યો હતો.

- દ. મુનિ નેમવિજયના ધર્મલાભ

સત્તાવાર પ્રગટ થયેલા પત્રો લેખકશ્રીને સ્વીકાર્ય નથી અને કહેવાતા ઉપજલી કાઢેલા તથા ૬૦-૬૦ વર્ષ સુધી રજુ ન કરી શકનારા અપ્રગટ પત્રો લેખકશ્રી વાંચકો સમક્ષ તદ્દન ખોટી રીતે તેના અંશો રજુ કરે છે તે લેખકશ્રીના મલિન આશયોને છતા કરે છે.

લેખકશ્રીના ભક્તો પણ હવે એટલા ભોળા નથી કે લેખકશ્રીની તદ્દન નિઝનક્ષાની આવી વાતો પણ સ્વીકારી લે ! હજી પણ તે પત્ર સાચો છે તેમ પુરવાર કરે યા મિચ્છામિ દુક્કડમ્ પાઠવે.

## લેખકશ્રીના દંબનો પર્દાકાશ

હેથામાં જે છે તે આવ્યા વિના રહેતું નથી

એક બાજુ લેખકશ્રી તેમના પ્રથમપુસ્તક (પૃષ્ઠ ૩) ઉપર પૂ. ઉમાસ્વાતિ ભગવાનના 'કષ્યેપૂર્વા'ના અર્થધટન અંગે જણાવે છે કે 'આપણે તેના અર્થધટનમાં પડવું નથી.' બીજુ તરફ લેખકશ્રી તેમના જ પ્રસ્તુત પુસ્તક ભાગ-૨માં પાના નં. ૨૫ ઉપર જણાવે છે કે, 'એટલે આઠમ ક્ષીણ તિથિ હોય ત્યારે સાતમને આઠમ કરીને આરાધના કરી દેવામાં ન આવે તો એ એક આરાધના ગુમાવવી પડે છે.' આમ લેખકશ્રીએ જે ઉપરોક્ત અર્થધટન કર્યું તે પૂ. ઉમાસ્વાતિ ભગવાન તેમજ તેમનાજ પ્રદાદાગુરુ આ.ભ.દાન સુ.મ. એ કરેલા અર્થધટનથી વિપરિત થયું. પછી ગુરુદ્રોહ ન લાગે લાગે તો બીજું શું લાગે ?

દા.ત. ૮-ક્ષીણ તિથિ હોય તો

પૂ.આ.ભ. દાન સુ.મ.ના મતે કષ્યેપૂર્વા મુજબ	૬,	૭+૮,	૯	થશે
લેખકશ્રીના મતે (કષ્યેપૂર્વાના વિપરિત અર્થધટન મુજબ)	૬,	૮,	૯	થશે

- ❖ પૂ.આ.ભ. દાન સુ.મ. સાતમમાં આઠમ સમાવે છે (૭+૮)  
(કષ્યેપૂર્વાનુસાર)
- ❖ લેખકશ્રી સાતમને આઠમ બનાવે છે (કષ્યેપૂર્વાનો લંગ)

આથી ત્રણ વાતો સ્પષ્ટ થઈ જાય છે

- ૧ લેખકશ્રીની બેધારી વાતો તેઓશ્રીનો દંબ છતો કરે છે
- ૨ પોતાના દાદા ગુરુભગવંતે 'કષ્યેપૂર્વા'નું જે અર્થધટન કર્યું તેનાથી વિપરિત અર્થધટન કરી લેખકશ્રીએ ગુરુદ્રોહ પણ સેવ્યો છે.
- ૩ છઠ-સાતમનું કોઈ કલ્યાણક હોય તો તેની આરાધના કયારે કરવી તેનો લેખકશ્રી પાસે કોઈ જ જવાબ નથી.

## પરિશિષ્ટ - ૧

સંઘસ્થવિર, વચનસિદ્ધ, સંયમતપોમૂર્તિ પૂ. આચાર્યદિવ શ્રી વિજય  
સિદ્ધસ્તૂરીશ્વરજી (બાપજી) મહારાજનો તિથિ અંગે અગત્યનો ખુલાસો  
યાને

તિથિ અંગે સત્ય અને હેરફેરીનો ઈતિહાસ

સં. ૧૯૯૭, કાર્તિક સુદ-પ્રથમ પૂનમ, ગુરુવાર, ચોમાસા  
પરિવર્તનનો પ્રસંગ, હાજ પેટેલની પોળ (અમદાવાદ), શ્રીવીશા  
શ્રીમાળીની વાડીમાં વ્યાખ્યાનમાં પૂ. બાપજી મહારાજએ તથા  
પૂ.આ.ભ.શ્રી વિ. ભદ્રંકરસૂરિજી મહારાજે (તે વખતે પૂ.મુ.  
શ્રીભદ્રંકર વિજયજી મહારાજે) તિથિ વિષયક શ્રી મોહનલાલ  
પોપટલાલ વકીલ દ્વારા પૂછાયેલા પ્રશ્નોના આપેલા ઉત્તરો.

પ્રશ્ન : બે પૂનમ સંબંધી આપની માન્યતા શું છે ?

ઉત્તર : ચતુર્દશી છતી વિરાધીને પૂનમે ચતુર્દશી કરવી એ  
મહાપાપ છે. માતાને ધાવવાથી બાળકની પુષ્ટિ થાય. પણ મરેલી  
માતાને ધાવવા થકી પુષ્ટિ થાય નહિ. પૂનમે ચોમાસી વગેરે થાય  
નહિ.

(નોંધ : બે પૂનમ હોય ત્યારે બે તેરસ કરી, પ્રથમ પૂનમે  
ચોમાસી-ચૌદસ ગાળી આરાધના થાય નહિ. કારણે પ્રથમ પૂનમ  
હકીકતમાં ચૌદસ જ નથી.)

પ્રશ્ન : આપે અત્યાર સુધી પહેલાં તેમ કરેલું તેનું શું ?

ઉત્તર : જુઓ લુખ્ખું ખાય તે ચોપદ્યાની આશાએ. આ

વાત એવી હતી કે બધા સમજુને સાચું કરે તો સાંદ્ર, પણ તેવો અવસર આવ્યો નહિ. વખતે વખતે મેં મારાથી બનતા પ્રયત્નો કર્યા, પણ જ્યારે છેવટે જેયું કે બધાની વાટ જેતાં આપુંથ જરો અને સાચી વાત મરી જરો. ત્યારે અમે જે પહેલેથી સાચું માનતા તે મુજબ આરાધવા માંડ્યું.

પ્રેરણ : આપે પરંપરા લોપી કહેવાય ?

ઉત્તર : પરંપરા શાની લોપી ? આ પરંપરા કહેવાતી હશે ? શાસ્ત્રની આજ્ઞાની વિરાધના થાય તેવી પરંપરા હોય જ નહિ. જુઓ તમને કોઈને કદાચ ખબર નહિ હોય પણ મારા અનુભવની વાત છે. આ વાત ૧૯૨૬ થી ૧૯૨૮ સુધીમાં બની છે. દેવસૂરના ઉપાશ્રયે નાગોરીશાળામાં ઘરણેન્દ્રક્ષી પૂજય હતા. તે વખતે પર્વતિથિઓની આવી હેરફેરી કરવાનું તેમણે કરેલું. તે વખતે સુખાજુ તેમની પાસે જતા હતા પણ ત્યારથી તેમણે ત્યાં જવાનું બંધ કર્યું. બે ચારવાર તેમને શ્રી પૂજયના કોટવાલો તેડવા આવ્યા પણ તેમણે કહી દીધું કે અસત્ય પ્રકૃપણા થઈ મારે હું નહિ આવું. તે વખતે શ્રી મૂલચંદજી મહારાજ વગેરેને પણ ધાણું દુઃખ થયું કે આ બધું ખોટું થાય છે. પણ તે વખતે સાધુઓ થોડા અને શ્રીપૂજયોનું બળ ધાણું. તે વખતે ઉહાપોહ પણ થયેલા પણ ચાલી પડ્યું. શ્રી મૂલચંદજી મહારાજ અને સુખાજુને એ વખતે જે કરવું પડ્યું તે બદ્દલ બહુ દુઃખ થયેલું બહુ પ્રશ્નાતાપ થયેલો. આવી રીતે ચાલેતી પરંપરા તે સત્ય કહેવાય કે અસત્ય ? તે વિચારો. અમે જાણતા હતા કે આવી રીતે પર્વતિથિની વિરાધના કરવી એ ખોટું છે. પણ

~~~~~

अमारा मनने एम के शासनमां बधा ठेकाणे आवशे. एम धारीने व्यर्णना हुये करता हुता. आपणे संमेलन थयुं ते वर्खते आ वात करी हती. पण ते वर्खते तो ‘आ विषय आपणा तपागच्छनो छे अने अहीं बीज गच्छोना पण आवेल छे.’ आथी पडती मूकाछि हती. ऐ वात रही ते रही अने बे पांचभो आवी, ऐ वर्खते भें ऐ भाटे प्रयत्न करेलो अने अमां उलटुं उंधुं थयुं. अने झेर रेहायुं. आथी विचार कर्यों के बधाने ठेकाणे लाववा. भाटे आपणे अशुद्ध करवुं ते ठीक नथी.

प्रश्न : पूज्य श्री आनंद विमलसूरीश्वरज्ञ महाराजना नामवाणुं सोणभी सहीनुं पानुं बतावे छे ते शुं ?

उत्तर : ऐ पानामां तेवुं लभाण छे ते तो जुओ ? ऐनी भाषा जुओ ? आपणा गच्छनी मान्यताथी विरुद्धनी गाथाओ आमां छे. पण ऐ बधी वात पछी. आपणे टूकी ज वात करीऐ. ऐ पानुं जे श्रीतपागच्छनी मान्यता मुजबनुं साचुं छे, एम पूरवार थठ जय तो हुं तेम मानवा अने करवा तैयार छुं. अरे भाई अत्यार सुधी अमे जे आ कर्युं तेनुं प्रायश्चित लेवा पण तैयार छुं.

प्रश्न : आपे सं. १८८२मां संवत्सरी शनिवारे हती छतां रविवारे करेली ऐ शाथी ?

उत्तर : ऐ वात तो ऐवी छे के.. ऐ वर्खते वाटाघाटनी शब्दज्ञनमां हुं ठगायो हतो. वातमां हुं फ्सायो, पण मारी श्रद्धा तो आ ज हती. ऐथी तो भें मारा बहास्ना साधुओने शनिवारे

સંવત્સરી કરવી એ જ બરાબર છે, એમ જાણાવી દીધું હતું. વળી મને કોઈએ પૂછ્યું કે પૂછાવ્યું તે બધાને મેં ભા. સુદ-૪ શાનિવારે જ સંવત્સરી કરવી જોઈએ, એમ કહ્યું હતું. મેં કહેલું કે - હું બોલમાં બંધાયો છું. પણ મારી શ્રદ્ધા એ જ છે કે, ભાહરવા સુદ-૪ને છોડીને ભાહરવા-સુદ પહેલી પાંચમે સંવત્સરી થાય જ નહિ. માટે હું તો એ જ કહેવાનો અને બને તેમની પાસે એ જ કરાવવાનો.

શાસ્ત્રોનું ચોપખું વચન છે કે..

(“ક્ષયેપૂર્વા તિથિ: કાર્ય વૃદ્ધૌ કાર્ય તથોત્તરા) ક્ષય હોય ત્યારે પૂર્વનીતિથિએ આરાધના કરવાની અને વૃદ્ધિ આવે ત્યારે ઉત્તરા એટલે પછીની તિથિએ આરાધના કરવાની.

આ નિયમ ક્ષય-વૃદ્ધિ વગરની તિથિએ કેમ લાગું પડે ? જુઓ કે પાંચમનો ક્ષય આવ્યો ત્યારે મનાયો અને ઉદ્ય તિથિની વિરાધના ન કરી, પણ વૃદ્ધિ આવી ત્યારે ઉદ્યતિથિ ચોથને વિરાધી. આ તો એવું થયું કે પરણવાની બાધા અને નાતડું મોકળું ! તેઓ વેરવૃત્તિ વધે એવું કરે છે, માટે આપણે બોલતા નથી-બાકી હડહડતું અસત્ય છે.

શાસ્ત્રની ચોક્ખી આજા છે અને તે મુજબ જ આપણે તે વખતે ૧૯૮૨-૧૯૮૩માં સંવત્સરીમાં અને તે પછી ચૌદસની પદ્ધતી તથા ચોમાસીમાં માન્યતા રાખી છે. તે પાનું જે સાચું સાબિત કરે તો આપણને તે માનવામાં કશો વાંધો નથી. બાકી ગમે તેમ ચાલી પડેલી અને સારી આશાએ નભાવેલી વાતને પરંપરા મનાય જ નહિ.

~~~~~  
લેખકશ્રીને નીચેના પ્રશ્નોના શાસ્ત્રાધારે ઉત્તરો આપવા નથી વિનંતી.

- પ્ર. ૧ એક તિથિ પક્ષ વારંવાર એવી જહેરાત કરે છે કે, ‘અમે સાચા હતા માટે પૂ.આ. ભુવનભાનુસુરિનો સમુદ્દરાય અમારામાં બળી ગયો.’ તો આપનો સમુદ્દરાય એક તિથિ પક્ષે શાસ્ત્રીય સત્ય હતું માટે બળ્યો કે અન્ય કારણે બળ્યો ? આપે અગાઉ જ જણાવી દીધું છે કે એકતિથિ પક્ષે શાસ્ત્રીય સત્ય છે નહિ.
- પ્ર. ૨ પર્વ તિથિની વ્યાખ્યા શી ?
- પ્ર. ૩ ‘પર્વ તિથિની ક્ષયવૃદ્ધિ હોય જ નહિ એ આપ માન્યતા ધરાવો છો ? શાસ્ત્રાધાર આપવા કૃપા કરશોલુ.
- પ્ર. ૪ ‘ક્ષયેપૂર્વા’ નું અર્થધટન જે આપના ઉપકારી પ્રદાદાગુરુદેવ શ્રીમહ વિજય દાનસૂરીશ્વરલુ મહારાજાએ આપના જ મહાત્માના પ્રકાશન ‘વિવિધ પ્રશ્નોત્તર’માં કર્યું છે તે આપને મંજુર છે ?
- પ્ર. ૫ ‘તિથિનો ક્ષય પણ અમુક મહિનામાં ન જ આવે અમુક મહિનામાં જ આવે, તેમાં પણ અમુક તિથિનો જ આવે, દરેક તિથિનો આવી રકે એવું નહિ....શાસ્ત્રોમાં આવું જ જણાવેલું છે’ તેમાં સિદ્ધાંત ટિપ્પણામાં પણ પર્વતિથિનો ક્ષય આવતો હતો તે આપ સ્વીકારો છો ?
- પ્ર. ૬ આપના દાદાગુરુ ભગવંતોએ આપની જેમ આજ પર્યત ઉદ્યાત્ ચોથ વિરાધી હોય તેવું ક્યારેય બન્યું છે ખરું ?

~~~~~

પ્ર. ૭ સિદ્ધાંત ટિપ્પણામાં પોષ અને અખાદ માસની જ વૃદ્ધિ હોવા છતાં લૌકિક પંચાંગના બીજા પણ અધિક માસ આપ સ્વીકારો છો ત્યાં કોઈ સંસ્કાર કરતા નથી. તે રીતે કલ્પસૂત્ર ગ્રંથની ટીકામાં પૂ. ઉ. વિનયવિજયજી મહારાજે શંકાનુનીચે મુજબ સમાધાન કર્યું તે આપને સ્વીકાર્ય કેમ નથી ?
... ભાદ્રપદવૃદ્ધૌ પ્રથમો ભાદ્રપદોડપિ અપ્રમાણમેવ,
યથા ચતુર્દશી વૃદ્ધૌ પ્રથમાં ચતુર્દશીમવગળ્ય દ્વિતીયાયાં
ચતુર્દશ્યાં પાદ્ધિકકૃત્યં ક્રિયતે તથાડત્રાપિ

અર્થ : ભાદ્રવા મહિનાની વૃદ્ધિ આવે ત્યારે પ્રથમ ભાદ્રવો અપ્રમાણ જ છે, જેમ ચૌદશની વૃદ્ધિ આવે ત્યારે ખેલેતી ચૌદશની અવગણના કરીને બીજી ચૌદશે પ્રતિકમણ કરાય છે, તેમ અહીં પણ

પ્ર. ૮ પૂ. સાગરજ મહારાજના પરસ્પર વિરોધી મંતવ્યો અંગે આપનો શો અભિપ્રાય છે ?

પ્ર. ૯ વિ.સં. ૨૦૪૨ના પછુકમાં જે આચાર્ય ભગવંતોએ સહી કરીને પાછી ખેંચી લીધી તે ગીતાર્થતા અંગે આપ ક્યા સંસ્કાર કરશો ?

પ્ર. ૧૦ વિ.સં. ૨૦૪૪ના સંમેલનના તિથિ અંગેના ઠારાવને સાગર સમુદ્દરના ગચ્છાધિપતિ આ. દર્શનસાગરસૂરિએ અમાન્ય જલેર કર્યો તો આપ તેને સંઘ અવજ્ઞા કહેશો ? કે પછી પાસત્થાના લક્ષણમાં ખપાવશો ? કે તેઓ સાચા હતા તેમ કહેશો ?

- પ્ર. ૧૧ વિ.સં. ૨૦૫૫મા તપસ્વીસમ્રાટ આ. હિમાંશુસૂરિએ પોતાના ગુરુભગવંતોને વક્ષાદાર રહી બા.સુ. ઉદ્યાત ચોથે આરાધના કરી તે યોગ્ય જ કર્યું હતું ?
- પ્ર. ૧૨ શુદ્ધ ઉદ્યતિથિ મળતી હોવા છતાં તેને પણ ફેરવી શકાય તેવું કયા શાસ્ત્રના આધારે આપ જણાવો છો ? શાસ્ત્રાધાર આપવા કૃપા કરશો ?
- પ્ર. ૧૩ સકલ સંઘને શાસ્ત્રસાપેક્ષ ઠરાવ કરવાનો અધિકાર છે કે શાસ્ત્રોને બાજુ પર રાખીને પણ ઠરાવ કરવાનો અધિકાર છે ?
- પ્ર. ૧૪ એક બાજુ આપ જણાવો છો કે ‘ક્ષયે પૂર્વા’ના અર્થધટનમાં આપણે પડવું નથી બીજુ બાજુ આપ આપના પુસ્તક ભાગ-રના પાના નં. ૨૫ ઉપર ‘એટલે આઠમ-ક્ષીણતિથિ હોય ત્યારે જે સાતમને આઠમ કરીને આરાધના કરી લેવામાં ન આવે તો એ એક આરાધના ગુમાવવી પડે છે.’ ઉપરોક્ત આપનું લખાણ આપના દાદાગુરુ આ.ભ. દાનસૂરીશ્વરજી મહારાજાએ કરેલા ‘ક્ષયે પૂર્વા’ના અર્થધટનથી વિપરીત ગુરુદ્રોહ કરનારું નથી ? અને જ્યારે આપ પાના નં. ૨૫ ઉપર ખોટો અર્થ કરો જ છો તો પછી ‘આપણે તેના અર્થધટનમાં પડવું નથી.’ તેવું ભદ્રિક જીવોને ભરમાવવાનું દુઃસાહસ શા માટે કરો છો ? તિથિ ઈનો ક્ષય છે તો,

(પૂ.આ. દાન સૂ.મ. ના મતે આરાધના ૭+૮, - ૬ તેમ થશે)
આપના મતે ૮, - ૬ તેમ થશે

તો ઇનો જો કોઈ પ્રતિષ્ઠા દિવસ હોય તો સાતમનું કાર્ય
ક્યારે કરવું તે જણાવશો. અને ઇછુનું કોઈ કલ્યાણક હોય
તો તે ક્યારે કરવું તે જણાવશો.

એકબાજુ ‘કથેપૂર્વી’નો અર્થ પાના ૨૫ ઉપર કરવો અને
બીજુ બાજુ આપણે તેના અર્થઘટનમાં પડવું નથી આવી
બેધારી વાત એ શ્રમણત્વને કલંક છે, ખેર ! હૈયામાં જે છે
તે આવ્યા વિના રહેવાનું નથી. પછી ગુરુદ્રોહનો અંશ પણ
લાગતો નથી તેમ કેમ કહેવાશે ?

પ્ર. ૧૫ પૂ. સાગરજી મહારાજએ શાસ્ત્રીય સત્ય માટે પોતાનો પક્ષ
રજુ કરેલો કે એકતા માટે ?

પ્ર. ૧૬ આપના મતે પૂ. સાગરજી મહારાજના પક્ષે શાસ્ત્રીય સત્ય
નહોતું તે બરાબર છે ને ?

(આપના પુસ્તક ભાગ-૧-પાના નં. ૨૬)

પ્ર. ૧૭ દ્રવ્યસત્ય અને ભાવસત્યના આપે કરેલા સ્વકલ્પિત
અર્થઘટન ક્યા શાસ્ત્રના આધારે છે તે શાસ્ત્રાધાર આપવા
કૃપા કરશો.

પ્ર. ૧૮ તત્ત્વતરંગિણીનો ‘જં જા જંમિ હુ દિવસે સમપ્પઙ્ગ સા પમાણંતિ’
‘ાસ્ત્રપાઠ આપને મંજુર છે ?

પ્ર. ૧૯ પૂ. ઉમાસ્વામિ ભગવાને 'વૃદ્ધો કાર્યો તથાત્તરા' એ શાસ્ત્રવચન શા માટે આખ્યું ?

પ્ર. ૨૦ એક તિથિ પક્ષ ત્રણસો વર્ષની પરંપરાને આગળ ધરે છે તો ત્રણસો વર્ષમાં વિ.સં. ૧૮૫૨ને છોડી તે પહેલાં કોઈએ પાંચમની ક્ષય વૃદ્ધિ એ ત્રીજની ક્ષય વૃદ્ધિ કરી હોય તેના નક્કર પુરાવાઓ આપશો ?

પ્ર. ૨૧ આપનો સમુદ્દ્રાય એકતિથિ પક્ષમાં ભળી ગયો તે, પૂર્વે આપે ખોટું કર્યું માટે જ ને ? અને ખોટું કર્યું તો તેનું પ્રાયસ્થિત કરેલું કે નહિ ?

પ્ર. ૨૨ જાણવા મુજબ પૂ.આ. ભુવનભાનુસૂરિ મ. વિ.સં. ૨૦૩૧ના વર્ષે જમનગર પાઠશાળાના ઉપાશ્રયે ચાતુર્માસ હતા. તેઓની નિશ્ચામાં ઉપધાન તપ નક્કી થયા હતા, ત્યારે ત્યાંના પાઠશાળાના ટ્રસ્ટીઓએ બે તિથિ બાબતમાં કંઈ વાંધો ઉઠાવ્યો, તો આ. ભુવનભાનુસૂરિ ચાલુ ચોમાસામાં તે સ્થાનનો ત્યાગ કરી પ્લોટના ઉપાશ્રયે પદ્ધાર્યા હતા. તો તમારા મતે સંકળ સંઘથી જુદા થવાનું થયું તો તેના અંગે કોઈ પ્રાયસ્થિત કર્યું ખરું ?

પ્ર. ૨૩ શ્રાદ્ધવિધિ પ્રકરણમાં ગ્રંથને ગ્રમાણિક ગ્રંથ માનો છો ?

પ્ર. ૨૪ લૌકિક પંચાંગમાં કોઈ માસનો ક્ષય આવે ત્યારે શું કરશો ?

પ્ર. ૨૫ સંમેલનના નવા અધ્યક્ષ ક્યારે જહેર કરશો ?

- પ્ર. ૨૬ છેલ્લા ૧૭ વર્ષમાં સંમેલને કરેલા ૨૨ ઠરાવોની સમીક્ષા તપાગચ્છ સમક્ષ કેમ કરવામાં આવતી નથી ?
- પ્ર. ૨૭ તિથિએ સિદ્ધાંત છે કે સામાચારી ?
- પ્ર. ૨૮ જે તિથિ સામાચારી છે તો ગુરુવારનો આગ્રહ શા માટે કર્યો ?
- પ્ર. ૨૯ શ્રી સંઘને પણ શાસ્ત્ર અને શાસ્ત્રાનુસારી પરંપરા મુજબ જ ઠરાવ કરવાનો અધિકાર છે તેમ આપ માનો છો ?
- પ્ર. ૩૦ ભા.સુ. બીજનો કષય આવે તો શું કરશો ? પૂ. જવેરસાગરજી મ. ને અનુસરશો કે પછી યતિ ધરણેન્દ્રને અનુસરશો ?
- પ્ર. ૩૧ યુગપ્રધાન કાલિકાચાર્યે રાજની ભા.સુ. ઇના સંવત્સરી કરવાની વિનંતી કેમ ન સ્વીકારી ?
- પ્ર. ૩૨ યુગપ્રધાન કાલિકાચાર્યે ચોથને કેમ પાંચમ ન બનાવી અર્થાત્ ચોથમાં પાંચમના સંસ્કાર કેમ ન કર્યા ?
- પ્ર. ૩૩ શું પ્રવર સમિતિ આપના લખાણ ભાગ-૧ તથા ભાગ-૨ને સ્વીકારશો ? અમને જાણવા મળ્યા મુજબ એક તિથિ પ્રકાના પણ ધણા મહાત્માઓ આપના લખાણ સામે નારાજ છે.
- પ્ર. ૩૪ સ્વ.આ. પ્રેમસૂરીશ્વરજી મહારાજનો વિ.સં. ૨૦૨૦નો પછું આપે કેમ છોડ્યો ?
- પ્ર. ૩૫ જે યુગપ્રધાન કાલિકાચાર્ય પણ ચોથને પાંચમ ન બનાવી શક્યા તો આપને પ્રથમ પાંચમને ચોથ બનાવવાના કુસંસ્કાર કરવાનું પ્રયોજન શું ?

- પ્ર. ૩૬ 'કષ્યેપૂર્વા'નું અર્થધટન એક બાજુ પૂ. આ. દાનસૂરીશ્વરજી
મહારાજાનું છે અને તેનાથી વિપરિત અર્થધટન પૂ. સાગરજી
મહારાજાનું છે તો આપને કયું અર્થધટન સ્વીકાર્ય છે ?
- પ્ર. ૩૭ શ્વેતાંબરોએ દિગંબરો સામે કોઈ કેસો કર્યા તે યોગ્ય કર્યું
છે કે પછી વારે વારે કોઈ કેસ શા કરવા ? તેમ કહેશો ?
ત્યાં ગીતાર્થ મહાત્માઓ કરતાં કોઈના જજ સાચો અર્થ
નહિ કરે તો પછી કોઈ કેસ શા માટે કરવા ?
- પ્ર. ૩૮ અખાદ સુદુર ઇનો ક્ષય આવે ત્યારે કલ્યાણકની આરાધના
ક્ષયારે કરશો ? તથા તે માટે શાસ્ત્રાધાર આપશો.
- પ્ર. ૩૯ સારુ છે કે આપ હજુ સુધી 'તપાગચ્છ' જ શબ્દ પ્રયોગ
કરો છો અને 'દેવસુર તપાગચ્છ' શબ્દ પ્રયોગ નથી કરતા
તો ભવિષ્યમાં 'તપાગચ્છ' જ ચાલુ રાખશો ને ?
- પ્ર. ૪૦ પદ્ધતી, ચોમાસી અને સંવત્સરી પ્રતિક્રમણને અંતે
સંતિકરમ્ભ બોતવાના વિધિ અંગે સ્વ. પૂ. આ. દાનસૂરિજીનું
મંતવ્ય જે વિવિધ પ્રશ્નોત્તર ભાગ-૨ પૃષ્ઠ ૧૮૦-૧૮૧-
પ્રશ્ન-૧૦૫માં જણાવ્યું છે તે આપને મંજુર છે ?
- પ્ર. ૪૧ વૃદ્ધિ પામેલા મહિનાને નપુંસક કહેશો કે નહિ કે પછી તેમાં
પણ પ્રતિષ્ઠા આદિ કાર્યો કરશો ?

~~~~~

પ્ર. ૪૨ આપશ્રી વારે વારે 'શ્રી સંઘે કરેલો નિર્ણય' શબ્દ પ્રયોગ કરો છો તો વાસ્તવમાં એમ જણાય છે કે આપશ્રી આપની સ્વમતિકલ્પિત માન્યતા શ્રી સંઘના નામે ચઢાવી દોછો. અન્યથા સંમેલનમાં ઠરાવ નં. ૧૦ પ્રમાણે છેલ્લા એક વર્ષમાં કોઈ પ્રવર સમિતિએ તે પ્રકારના ઠરાવો કર્યા નથી જે સંમેલનને પણ બંધનકર્તા બને તો આપશ્રીનું કોઈપણ લખાણ શ્રી સંઘનું લખાણ છે તે માત્ર આત્મવંચના જ નથી ?

પ્ર. ૪૩ સ્વ. પૂ. આ. ભ. પ્રેમસૂરીશ્વરજી મહારાજની માન્યતાનુસાર ગ્રહણ વખતે દેરાસરો ઉધાડા રાખવા તથા વ્યાપ્યાન વાંચવાની પ્રવૃત્તિ યોગ્ય જ છે તે આપ સ્વીકારો છો ?

પ્ર. ૪૪ શેઠશ્રી કસ્તુરભાઈ લાલભાઈએ, એક તિથિ પક્ષે લવાદી પંચે આપેલા ચૂકાદાને કબૂલ નહિ કરતાં જે દુઃખ નિવેદન આપેલું તેને આપ યોગ્ય જ માનો છો ? કારણકે આપના જણાવ્યા મુજબ બધાં એક દિવસે શાસ્ત્રીય આરાધના કરે અને તે માટે જ શેઠશ્રી કસ્તુરભાઈએ બન્ને આચાર્યોની સંમતિથી લવાદી પંચની નિમણંક કરેલી અને જે એનો નિર્ણય સ્વીકાર્ય થયો હોત તો બધા આજે એક દિવસે જ આરાધના કરતા હોત ! માટે પૂ. સાગરજી મ. એ લવાદી પંચે આપેલા ચૂકાદાને ન સ્વીકારી બધાની એક દિવસે થતી આરાધનામાં ભંગાળ પાડ્યું છે તે આપ માનો છો ?

~~~~~

- પ્ર. ૪૫ બેસતા વર્ષે જે વાર હોય તેજ વાર સંવત્સરીનો હોય છે તેવો એકતિથિ પક્ષ પ્રચાર કરે છે તો આપનો અભિપ્રાય આપશો.
- પ્ર. ૪૬ સિદ્ધાંત ટિપ્પણામાં પણ પર્વતિથિનો ક્ષય આવતો હતો તો ક્ષયતિથિની આરાધના કેવી રીતે થતી ?
- પ્ર. ૪૭ આપના ભાગ-૨ પુસ્તકમાં પૃ. ૨૫ ઉપર આપ જણાવો છો કે, ‘મુહૂર્તમાં ક્ષીણતિથિ ન લઈએ તો પણ કોઈ હાનિ નથી’ આનો અર્થ એમજ થાય છે કે, ‘મુહૂર્તમાં ક્ષીણ તિથિ લઈએ તો પણ કોઈ હાની નથી’ તે બરાબર છે ? અને હાનિ નથી તો તે વજ્ય જ શા માટે કહી ?
- પ્ર. ૪૮ આપ જણાવો છો કે ક્ષીણ તિથિ વજ્ય જ કહી છે. હવે જે તિથિ મુહૂર્તમાં છે તે પછીના વર્ષગાંઠના દિવસે ક્ષીણતિથિ હોય તો વર્ષગાંઠ કેવી રીતે મનાવવી ? કે પછી આખી વર્ષગાંઠ જ વજ્ય ગણવી ?
- પ્ર. ૪૯ આપના પુસ્તક ભાગ-૨ના પૃષ્ઠ. ૩૧ ઉપર આપ જણાવો છો કે, ‘તિથિ અંગે આપણા શાસ્ત્રોએ જે નિદ્રપણ કર્યું છે એના કરતાં લૌકિક પંચાંગની તિથિઓ અલગ પડી જય છે’ હવે જ્યારે પ્રતિષ્ઠા વિ. મુહૂર્ત જે લૌકિકપંચાંગના આધારે નિકળે છે તે મુહૂર્ત પણ જૈન શાસ્ત્રોની તિથિ

પ્રમાણે તો નથી જ આવવાના. તેથી તેના ઘડી, પળ વિ.
બધુજ જૈન શાસ્ત્રો પ્રમાણે તો નથી જ આવવાના તો તે
પ્રતિષ્ઠા આઈના મુહૂર્તની તિથિ, ઘડી, પળ વિ.
સાચવવાનો આગ્રહ શા માટે કરવો ?

પ્ર. ૫૦ પૂ.આ.ભ. ગ્રેમસૂરીશ્વરજી મહારાજાએ પંડિત શ્રી કુંવરજી
આણંદજીને લખેલા પત્રાનુસાર શેઠશ્રી કસ્તુરભાઈ લાલભાઈ
દ્વારા પંચના તિથિચર્ચાના નિર્ણય અંગે જણાવે છે કે, ‘એ
નિર્ણય મુજબ ચાલવામાં દરેક દરેક તિથિનું આરાધન આજા
મુજબ થાય છે અને મહત્વના પર્વની વિરાધનાથી પણ
સારી રીતિએ બચી શકાય છે’ તો આપના દાદાગુરુભગવંતના
ઉપરોક્ત માન્યતામાં આપ સહમત છો ?

હીરપ્રભોતર - ‘તિથિ આચરણા છે’ તેમ ક્યાંય જણાવ્યું નથી ‘આચરણા’ ની વાત કરનારા લેખકશ્રીએ પોતાના જ ‘ભાવસત્ય’નો છેદ ઉડાવી દીધો !

પર્વતિથિની આરાધના તે આચરણા કે સિદ્ધાંત ? પુછનારા લેખકશ્રી શ્રી હીર પ્રભુના (પ્રભુ ૧ થી ૧૫ના) ઉત્તરમાં ક્યાંય તે આચરણા છે તેમ પુરવાર કરી શક્યા નથી. અને જે તિથિ આચરણા જ છે તો ગુરુવારની હઠ શા માટે ? બુધવારે સંવત્સરી કરવામાં વાંધો ક્યાં આવ્યો ?

પહેલાં શાસ્ત્રીયસત્ય, પછી દ્રવ્ય સત્ય, પછી ભાવ સત્ય અને હવે આચરણા, માટે જ ઉપા. યશોવિજયણ મહારાજ લખે છે કે, ‘સૂત્ર આવશ્યક ઘરઘરનું કહેશે તે અજ્ઞાની; પુસ્તક અર્થ પરંપર આવ્યું માને તેહજ જ્ઞાની.’ (૧૫૦ ગાથાનું સ્તવન)

તેજ વાત પ્ર. આનંદધનણ મહારાજ જણાવે છે કે, ‘સૂત્ર (શાસ્ત્ર) અનુસાર જે લખિક ડિરિયા કરે તેહનું શુદ્ધ ચારિત્ર પરિખ્યો’ ‘વચન (શાસ્ત્ર) નિરપેક્ષ વ્યવહાર જુઠો કલ્યો.’

હવે લેખકશ્રીનો આ ભત્તિવિપર્યાસ અટકે તો સારું !

તો પછી કલ્પસૂત્રાનુસાર બે ચૌદસ માનવામાં વાંધો શું ?

જેમ બે ચૈત્ર માસ હોય છે તો બીજ ચૈત્ર માસમાં ચૈત્ર સુદ ૧૩ પ્રભુ મહાવીર જન્મ કલ્યાણક ઉજવાય છે.

જેમ બે વૈશાખ માસ હોય છે તો બીજ વૈશાખમાં વૈશાખ સુદ ૩ (અખાત્રીજ) વર્ષીતાપના પારણાં થાય છે.

જેમ બે ભાદ્રવા હોય તો બીજ ભાદ્રવામાં સંવત્સરી થાય છે. તેમ કલ્પસૂત્રમાં જણાવ્યું છે કે,

બે ચૌદસ હોય તો બીજ ચૌદસે પાક્ષિક ફૃત્ય થાય છે. શ્રી કલ્પસૂત્રાનુસાર તે રીતે સર્વ પર્વ તિથિમાં સમલ લેવું. બે ચૌદસ હોય જ નહિ તે તો ભત્તિવિપર્યાસ જ કહેવાય !

આ તે કેવો ન્યાય ? લેખકશ્રીની ઉત્તાનમતિ !

- લેખકશ્રી અંતિમ પૃષ્ઠ ઉપર 'આતે કેવો ન્યાય' માં જણાવે છે કે,
1. વિ.સં. ૧૯૯૨ સુધી પુનમ-અમાસની ક્ષયવૃદ્ધિએ તેરસની ક્ષયવૃદ્ધિ કરી (લેખકશ્રીનો સમુદ્દર્ય પણ સાથેજ હતો)
 2. પછી પુનમ અમાસની જ ક્ષયવૃદ્ધિ કરી (ત્યારે પણ લેખકશ્રી સાથે જ હતા)
 3. પછી વિ.સં. ૨૦૪૨ સુધી પાઈ તેરસની ક્ષયવૃદ્ધિ કરી (ત્યારે પણ લેખકશ્રી સાથે જ હતા)
 4. પછી પાઈ પુનમ-અમાસની ક્ષયવૃદ્ધિ ચાલુ કરી (ત્યારે તો લેખકશ્રીએ પૌતાના ગુરુભગવંતોની અને શાસ્ત્રની વક્ફાદારી છોડી દીધી !) ખોટું ખોટું સમજુને કરનાર સત્ય માર્ગ આવી જય. જ્યારે લેખકશ્રી હવે ખોટાને સાચુ સિદ્ધ કરવા પ્રયત્ન કરે છે તેનો ભારે અફસોસ છે !

પૂ. બાપજી મહારાજના શબ્દોમાં,

'જુઓ લુખ્યાં ખાય તે ચોપદ્યાની આશાએ. આ વાત એવી હતી કે બધા સમજુને સાચું કરે તો સાંદ્ર, પણ તેવો અવસર આવ્યો નહિ. વખતે વખતે મૈ મારાથી બનતા પ્રયત્નો કર્યા, પણ જ્યારે છેવટે જેથું કે બધાની વાટ જેતાં આપ્યુંય જશે અને સાચી વાત મરી જશે. ત્યારે અમે જે પહેલેથી સાચુ માનતા તે મુજબ આરાધવા માંડયું.'

"શાસ્ત્રની આજા મુજબ આરાધના થાય એ માટે મૈ મારાથી બનતો ઘણો પ્રયત્ન કર્યો છે, પણ જેને જુદ્ધી વાતો કરવી હોય તે જે છે તે ગમે તેમ કહે. એમાં આપણો શુ કરીએ ? દુનિયામાં દુર્જનોનો તોટો નથી. દુર્જનનો સ્વભાવ જ એવો હોય છે.'

પૂ. બાપજી મહારાજ

સંઘ અવજ્ઞા-

શાસ્ત્ર-ચૈત્યવંદન મહાભાગ્ય

પોતાની કિયાને વખાણવી અને સકલ સંધના વ્યવહારને દોષિત કરવો એનાથી પણ અધિક સંધની અવજ્ઞા બીજુ કોઈ હોઈ શકે ? અર્થાત્ આનાથી અધિક બીજુ કોઈ સંધની અવજ્ઞા નથી.

ઉપરોક્ત લેખકશ્રીનું લખાણ વિ.સં. ૨૦૪૪ના સંમેલનની બનેલી દુઃખ ઘટનાઓને બરાબર બંધ બેસતુ આવે છે. હવે લેખકશ્રી તેના બચાવમાં કયા સંસ્કારો કરશે તે લેખકશ્રી જ જાણો !

વાસ્તવમાં શાસ્ત્રપાઠો નહિ આપી શકનારા લેખકશ્રીએ ચૈત્યવંદન મહાભાગ્યના નીચેના પૂ.આ. શાંતિસૂરિલ મ.ના શાસ્ત્રપાઠો નજર અંદાજ કરવા જેવા નથી.

એકકં ન કુળા મૂઢો, સુયમુદ્દિસિકુળ નિયકુબોહંમિ ।
જણમન્ત્રં પિ પછ્છાઙ્સ, એય બીયં મહાપાવં ॥

મૂડ લું શાસ્ત્રને લક્ષ્યમાં લઈ પોતે કસ્તો નથી તે પહેલું મહાપાપ છે,
અને પોતાના કુલોધમાં બીજા લોકોને પણ પ્રવતાવિ છે એ બીજું મહાપાપ છે.

નતિથિ પરલોગમબ્દો પમાણમન્ત્ર જિણાગમં મોતું ।

આગમપુરસ્કરં ચિય કર્યેઝ તો સાખ્વકિચ્ચાં ॥

પરલોક માર્ગમાં જિનાગમ વિના અન્ય કોઈ પ્રમાણભૂત નથી તેથી
સધણા કાર્યો આગમમાં બતાવ્યા મુજબ જ કરે.

ચૈત્યવંદન મહાભાગ્ય-પૂ.આ.શ્રી શાંતિસૂરિલ મ.

ઉપરના શાસ્ત્રપાઠોમાં ક્યાંય એકતા ખાતર શાસ્ત્રપાઠોને ગૌણ કરવા
તેવું જણાવ્યું નથી. માટેજ શાસ્ત્ર સાપેક્ષ એકતા જ વાસ્તવમાં એકતા
છે અન્યથા એકતાલાસ જ રહેશે.

પાસત્થાનું લક્ષણ અને ૨૦૪૪નું સંમેલન

...ગણભેઅતતિલો ॥ (ગા.ન. ૩૬૧) ઉપદેશમાતા.

શ્રી સિદ્ધર્થિકૃત ટીકા : ગણો - ગચ્છસ્તસ્ય ભેદ: પરસ્પરં ચિત્તલિશ્લેષ: તસ્મિન् 'તત્ત્ત્વિલો'તિ તપ્તિમાન્ ગણભેદતપ્તિમાન્ - ગચ્છવિઘટન તત્પર ઇત્યર્થ: ॥

શ્રી લૈન આત્માનંદ સભા - પ્રકાશિત ભાષાન્તર :

'ગણ એટલે સંધારાનો લેદ કરવામાં અંદર અંદર કુસંપ કરાવવામાં તત્પર તત્પર રહે છે. (આ પાસત્થા વગેરેનું દોષ-સ્થાન છે.)

ઉપરોક્ત લેખકશ્રીએ કરેલું વર્ણન, નીચે મુજબ વિ.સં. ૨૦૪૪ના સંમેલનમાં બનેલી ઘટનાઓમાં બંધ બેસતું જણાય છે.

સંમેલનના અધ્યક્ષના પત્રના અંશો

- ૧ કેટલાય સમુદ્દ્રાય તેમાંથી સત્તાવાર કે બીન સત્તાવાર રીતે ખસતા ગયા.
- ૨ તે અંગે આપણા તરફથી કોઈ પ્રતિક્રિયા પણ કરવામાં આવી નથી.
- ૩ વળી વિ.સં. ૨૦૪૪ની સાતમાં ૯ પ્રવર સમિતિમાં નક્કી થયેલા પાંચ સભ્યોમાંથી સીધા ૧૮ (બધા ૯)ને પ્ર.સ.માં સ્થાન આપવું પડ્યું તેની પાછળના આશયથી (એટલે સ્વભાવિક છે કે અંદર અંદરના થયેલા કુસંપો) પણ આપ અન્જણા નહિન હોય ?
- ૪ તે વખતે પરિસ્થિતિ એટલી બધી વાણસી ચૂકી હતી કે જે તે-તે માંગણી કરનાર સમુદ્દ્રાને આ સમિતિમાં પ્રવેશ ન મળે તો સંમેલનથી છૂટા થવાની તૈયારી વાળા હતા (અંદર અંદરના કુસંપની પરાકાઢા !)
- ૫ મારી સ્પષ્ટ અસંમતિ છતાં અનેકના અતિશય દ્વારાણને કારણે મન ન હોવા છતાં આ વાત સ્વીકારવી પડી. પ્રવરસમિતિના વિસ્તૃતીકરણથી સંમેલનની રહી સહી નક્કરતા પણ ખોખરી થઈ ગઈ એવું મને લાગે છે. (અંદર અંદરના કુસંપના કારણે સંમેલન ખોખડ થઈ ગયું તેનો સ્વીકાર !)
- ૬ સંમેલનની એક વાક્યના ટકવાને બહાલે શાસનમાં હાલ ૪-૫ વિભાગ થઈ ચૂક્યા છે (અંદર અંદરના કુસંપથી ગણ એટલે સંધારામાં થયેલા ભેદો !)
- ૭ દૂકડા વધે તેવી એકતા, એકતા કહેવાશો ?
(ખરેખર ! ગણભે અતતિલો)

સકળ સંઘને વિનગ્ર નિવેદન

એકવાર આપશી તિથિ અંગેનો અભ્યાસ તટસ્થ રીતે
બન્ને પક્ષાનો જાણી લો.

શાસ્ત્રાધારો અને શાસ્ત્રાનુસારી પરંપરા જાણી લો.

સત્યના ગવેષક બનો.

માદ્યસ્થલાવે નિર્ણય કરો.

સત્ય તમારા હાથમાં છે.

ભા.સુ. પ ના કથે શુ કરશો ? આગોતરી નિષ્ઠા જહેર કરો !

લેખકશ્રીના ફરતા વિચારો - સૌના હદ્યમાં સદેહ

લેખક પૂજ્યશ્રીને વિનંતી કે જ્યારે સંઘ માન્ય જન્મભૂમિ પંચાંગમાં ભા.સુ. પ નો કથ્ય આવશે ત્યારે,

- ૧ પૂ. આત્મારામજી મહારાજના શાસ્ત્રાનુસારી મંતવ્ય અનુસાર ભા.સુ. ઉદ્યાત્ત્ર્ય સાચવશો અને પાંચમના કાર્યો પણ 'કથેપૂર્વી' પ્રધોષાનુસાર તેજ દિવસે કરશો ?
- ૨ પૂ. બાપજી મહારાજ, પૂ. દાનસૂરીશ્વરજી મહારાજ, પૂ. પ્રેમસૂરીશ્વરજી મહારાજની પણ તેજ માન્યતાનુસાર ગુરુદ્રોહનો અંશ પણ ન લાગે તે રીતે કરશો ?
- ૩ વિ.સં. ૨૦૪૨ના પછુક અનુસાર કરશો ?
- ૪ વિ.સં. ૨૦૪૪ના સંમેલનના ઠરાવ અનુસાર પાંચમના કથે છઠનો કથ્ય કરી ઉદ્યાત્ત્ર્ય ચોથ સાચવશો ?
- ૫ સંમેલનથી છૂટા પડ્યા બાદ સ્વ.પૂ. ગચ્છાધિપતિ દર્શનસાગર સ્તૂરિએ આપેલ જહેરાત અનુસાર પાંચમના કથે ત્રીજનો કથ્ય કરી આરાધના કરશો ?
- ૬ એકતાના નામે વળી કોઈ નવાજ સંસ્કાર (કુસંસ્કાર !) કરશો ?

લેખકશ્રી, પોતાના ફરતા વિચારો અંગે લોકોમાં જે સદેહ છે તેનો આગોતરો ખુલાસો કરી તે સદેહ દૂર કરે તેવી અતિ નમ્ર ભાવે વિનંતિ.

લોકોમાં સદેહ જણાય છે કે લેખકશ્રી ઉદ્યાત્ત્ર્યને વિરાધી ભા.સુ. ત્રીજનો કથ્ય કરી કદાચ આરાધના કરે !

પૂ. આ. પ્રેમસૂરીશ્વરજી મ.ને વક્તાદાર રહેવાની છેલ્લી તક !

આ વખતે વિ.સં. ૨૦૬૨, કા.સુ. ૧૫ના ક્ષયે શું કરશો ?

સિદ્ધાંત મહોદધિ આચાર્ય દૈવેશ શ્રીમહૃ વિજય

પ્રેમસૂરીશ્વરજી મહારાજનો ખુલાસો.

સમાચાર સાર

પૂ. આચાર્યદિવશ્રીનો કારતક ૧૫ અંગે ખુલાસો

પૂ. સિદ્ધાંતમહોદધિ આચાર્યદિવ શ્રીમહૃ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજ તરફથી શ્રી સંઘને જણાવવાનું કે વિ.સં. ૨૦૧૮માં કાર્તિક સુદ ૧૫નો ક્ષય હોવાથી તા. ૧૧-૧૧-૧૯૬૨ રવિવારે ચૌદસ-પૂનમ ભેગા છે. આથી તે દિવસે સવારે કાર્તિકી પૂનમની શ્રી સિદ્ધગિરિજની અથવા ગિરિરાજના પટની યાત્રા કરવી કેમકે-પૂર્વે ચોમાસી પૂનમની હતી અને કાર્તિક પૂર્ણિમાની યાત્રાનો મહિમા તે વખતે પણ હતો જ. વળી તે દિવસે ઔદયિક ચતુર્દશી હોઈને ચોમાસી પ્રતિક્રમાણ આદિ પણ તે દિવસે જ કરવું અને કા.વ. ૧ સોમવારે ચોમાસુ બહલવાનું રાખવું.' (દિવ્યદર્શન તા. ૨૭-૧૦-૬૨, પૃ. ૪૦)

લેખકશ્રીએ તો ઉપકારી ગુરુ ભગવંતનો શુદ્ધ શાસ્ત્રીય માર્ગ પણ છોડ્યો અને અપવાહિક આચરણ સ્વરૂપ ૨૦૨૦નો પદ્ધક પણ છોડ્યો. અને

- જેમણે વિ.સં. ૧૯૮૨માં સકળસંધથી અલગ સંવત્સરી કરી,
- જેમના ખુદના લખાણો પરસ્પર વિરોધી છે.
- જેમણે લવાદી ચુકાદાની લેખિત કબૂલાત ના કબૂલ કરી,
- જેમના માટે શેઠશ્રી કસ્તુરભાઈ લાલભાઈને પણ દુઃખ નિવેદન જરી કરવું પડ્યું.

- જેઓ વિ.સં. ૨૦૪૨ના પદ્ધકમાં પણ સહી કરીને ફરી ગયા અને જેમણે સંમેલનમાં તિથિના અશાસ્ત્રીય નિર્ણયો લીધા તેમના માટે એક હરુ પણ નહિ ઉચ્ચારનાર અને ઉપરથી તેમના ભસીહા બનનાર લેખકશ્રી પોતાના દાદાગુરુ ભગવંત માટે તેમણે પ્રાયસ્થિત કર્યું તેમ જણાવે છે.

સામે ચઠીને કોઈના પક્ષે જઈએ તો કેવી નિઝકક્ષાએ ઉત્તરવું પડે છે તે સાક્ષાત દાખિ ગોચર થાય છે.

એક વાત જગ જાહેર છે કે સામે ચાલીને લેખકશ્રી તે પક્ષમાં ગયા છે માટે તેમને તો એ લોકો કહે તે પ્રમાણે મતુ માર્યા વગર છુટકો જ નથી. ૨૦૪૨માં કહું તો તે પ્રમાણે મતુ માર્યું તેનાથી વિપરિત ૨૦૪૪માં મતુ માર્યું અને કયાં શું માર્યો તે કહી શકાય તેમ નથી. એમ અત્યારે તો જાણાય છે.